## NARMADA AGROBASE LTD.

### Mfg. Delinter Cotton Seeds & Cattle Feed

र्ख्य छापू पशु आहार

CIN NO: L15494GJ2013PLC073468

Date: 09/09/2023

To,
Head - Listing Operations,
BSE Limited,

P.J. Towers, Dalal Street, Fort, Mumbai – 400 001.

To,

The Corporate Relations Department

National Stock Exchange of India Ltd.

Exchange Plaza, C-1, Block G, Bandrakurla Complex,

Bandra (E), Mumbai - 400051.

SYMBOL: NARMADA SCRIPT: 543643

Dear Sir,

Sub: Newspaper Publication regarding the 11th Annual General Meeting to be held through Video Conferencing/ Other Audio Visual Means

This is to inform you that the Company has published today the newspaper advertisement with regards to captioned subject in the following newspapers:

- 1. Financial Express English edition, Ahmedabad
- 2. Financial Express, Gujarati edition (Vernacular Language)

Copies of the above notice as published in the newspapers are enclosed herewith.

You are requested to kindly take the above information on your record.

Thanking you,

Yours Faithfully

FOR NARMADA AGROBASE LIMITED

NEERAJKUMAR SURESHCHANDRA AGRAWAL Chairman and Managing Director (DIN: 06473290)

**Encl: As Above** 

Corp. Office: 401, Silicon Tower, Above Freezeland Restaurant, Nr. National Handloom, Law Garden, Ellisbridge, Ahmedabad-380009.

Tel.: +91-79-26448824, 40370886 ◆ Mob. 94260 88802, 92274 04061

## NOTICE OF LOSS OF SHARES OF **HINDUSTAN UNILEVER LIMITED**

(Formerly Hindustan Lever Limited) Regd. Off. Hindustan Unilever Limited, Unilever House, B D Savant Marg, Chakala, Andheri (East), Mumbai - 400 099 Notice is hereby given that the following share certificates have been reported as lost/misplaced and the Company intends to issue duplicate certificates in lieu thereof, in due course.

Any Person who has a valid claim on the said shares should lodge such claim with the Company at its Registered Office within 15 days hereof. No. of shares Certificate (Rs.1/-f.v) No.(s) Distinctive No.(s) Name of the Folio Shareholder Annapurna Trivedi 5279821 1160564371-HLL2962554 520 (Deceased) 1160564890 Rajesh Gunvantrai Trivedi (Claimant) Date: 07-09-2023 Place : Ahmedabad

# ■ SISL INDUSTRIES LIMITED

Registered Office: Village - Mogar, Dist. Anand - 388 340, (Gujarat) CIN-L31100GJ1966PLC001397, Website: www.jslmogar.com Tel. No. 02692 - 280224, Email: cs@jslmogar.com

Notice is hereby given that the shareholder Mr. Saatyaki Anant Amin, has informed having lost his following share certificates and the same are not traceable and he has applied for the duplicate share certificates in lieu of the lost original share certificates:

1. Folio No. 00010022, holding 12,825 Equity Shares, in the name of Saatyaki A Amin bearing certificate nos. 477-487, 2489-2499, 3350-3370, 3664-3673, 3694-3699, 3707-3715, 903706, 3737, 5723-5739, 9180030, 190106, 5808.

The person having any claim/dispute/objection, in respect of issue of duplicate share certificates, should obtain an injunction order from the competent court restraining the Company not to issue duplicate share certificates in question and submit the said order to the Company at the Registered Office address or Company's Registrar and Share Transfer Agent at its below mentioned address, within 15 (Fifteen) days from the date of publication of Notice, failing which the Company/RTA will take further action as deemed appropriate in the matter for issue of duplicate share certificates.

Registrar and Share Transfer Agent:

MCS Share Transfer Agent Limited Unit: JSL Industries Limited 1st Floor, Neelam Apartment 88, Sampatrao Colony Alkapuri, Vadodara - 390007 Tel: (0265) 2314757; 2350490 Email: mcsltdbaroda@gmail.com

Date: September 08, 2023 Place: Mogar

FOR JSL INDUSTRIES LIMITED Ravi Thanki Company Secretary

# RIDDHI CORPORATE SERVICES LIMITED

CIN: L17290GJ2005PLC046345 Registered Add: 10 Mill Officers Colony, Behind Old Rbi, Ashram Road Ahmedabad Gj 380009

Phone: 079-26580767, Email: investor@rcspl.net. Web: www.riddhicorporate.co.in NOTICE OF THE 13™ ANNUAL GENERAL MEETING.

**BOOK CLOSURE AND REMOTE E-VOTING INFORMATION** 

Notice is hereby given that the 13<sup>th</sup> Annual General Meeting (13<sup>th</sup> AGM) of the Members of Riddhi Corporate Services Limited will be held on Thursday, 28<sup>th</sup> September, 2023 at 11:00 a.m. to transact the business, as set out in the Notice of the 13" AGM. The Company has sent the Annua Report along with Notice convening AGM on Wednesday, 6° September, 2023, through electronic mode to all the Members whose e-mail IDs are registered with the Company's Registrar & Share Transfer Agent, M/S. PURVA SHAREGISTRY (INDIA) PVT. LTD/Depository Participant(s) in accordance with the Circular issued by the Ministry of Corporate Affairs dated 5" May, 2020 read with its circulars dated 8" April, 2020 and 13" April, 2020 and the Securities and Exchange Board of India circular dated 12" May, 2020. The Annual Report along with the Notice convening the AGM is also available on the website of the Company at www.riddhicorporate.co.in, BSE Limited at www.bseindia.com and on the website of Central Depository Services (India) Limited (CDSL) at www.evotingindia.com Notice is also hereby given that pursuant to the provisions of section 91 of the Companies Act,

2013; the Register of Members and Share Transfer Books of the Company will remain closed from Friday 22" September, 2023 to Thursday 28" September, 2023 (both the days inclusive) for the

Pursuant to the provisions of Section 108 of the Act and Rule 20 of the Companies (Managemen and Administration) Rules, 2014 as amended and Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, members are provided with the facility to cast their vote electronically through e-voting services provided by the CDSL on all resolutions as set forth in the 13" AGM Notice. The voting rights of the members shall be in proportion to the equity shares held by them in the paid-up equity share capital of the Company as on Thursday, September, 21, 2023 ('cut-off date').

The remote e-voting period commences on Monday, 25th September, 2023 at 9.00 a.m. and will end on Wednesday, 27" September, 2023 at 5.00 p.m. During this period, the Members may cast their vote electronically. The remote e-voting module shall be disabled by CDSL thereafter. Those Members, who shall be present in the AGM and had not cast their votes on the Resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-voting system during the AGM.

The manner of remote e-voting and voting at the AGM by members holding shares in dematerialized mode, physical mode and for members who have not registered their email addresses is provided in the Notice of the AGM.

Any person, who acquires shares of the Company and becomes a Member of the Company after the Notice has been sent electronically by the Company and holds shares as on the cut-off date may obtain the login ID and password by sending a request to helpdesk evoting@cdslindia.com However, if he/she is already registered with CDSL for remote e-voting, then he/she can use his/her existing User ID and password for casting the votes.

Registration of e-mail addresses: Members whose email addresses are already registered with the Company/Depositories, may follow the instructions for e-voting during the AGM as provided in the Notice of the AGM. Members whose email addresses are not registered with the Company/Depository may follow the below process for registering or updating their email addresses.

Members holding shares in electronic/ Demat form, please update your email address with your Depository Participants. However, Members may temporarily register the same with the Company's Registrar & Share Transfer Agent i.e. M/S PURVA SHAREGISTRY (INDIA) PVT. LTD at https://www.purvashare.com/email-and-phone-updation/on their website www.purvashare.com/ in the Register your Email id tab by providing details such as Name, DP ID. Client ID, PAN, mobile number and e-mail address.

n case of any queries pertaining to e-voting members may refer to the Frequently Asked Questions ("FAQs") and the e-voting manual available at www.evotingindia.com, under help section or write an email to helpdesk, evoting@cdslindia.com

Place : Ahmedabad Date: 6" September, 2023 FOR, RIDDHI CORPORATE SERVIES LIMITED sd/- MUSTAFA MUFADDALBHAI SIBATRA Compliance Officer & Company Secretary



### HERO FINCORP LIMITED

CIN: U74899DL1991PLC046774 Regd Office: 34, Community Centre, Basant Lok, Vasant Vihar, New Delhi-110057 Tel: 011-49487150 Fax: 011-49487150 Email: litigation@herofincorp.com Website: www.herofincorp.com

Ahmedabad - 380001

"APPENDIX-IV-A" [SEE PROVISO TO RULE 8(6)] SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTY E-AUCTION SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTY IN TERMS OF SECURITISATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002 READ WITH PROVISO TO RULE 8(6) OF THE SECURITY INTEREST (ENFORCEMENT) RULES, 2002

Notice is hereby given to the public in general and in particular to the Borrowers (B) that the below mentioned immovable property mortgaged / charged to the Secured Creditor (Hero Fincorp Limited), the physical possession of the below mentioned mmovable property has been taken by the Authorized Officer of Secured Creditor (Hero Fincorp Limited), will be sold on "As is where is Basis" & "As is what is Basis" & "whatever there is Basis" & "Without recourse Basis" on below mentioned date, for recovery of amount as mentioned below, due to the Secured Creditor from the Borrower. The Reserve Price is mentioned

Name of the Borrower (B) / Guarantors (G) / with Address	Address of the Security charged covered under Auction	Reserve Price (RP)
1. M/s Vkalp Consultancy Pvt. Ltd. Having its registered office at: F-9,		Rs.53,00,000/-
	Floor, in the scheme known as "Relief Arcade", situated City	EMD Amount 10% of the Reserve Price
2. Mr. Kalpesh Hasmukhbhai Chauhan R/O 8-21, Vishal Tower,	Survey No. 2122 paiki, Mouje:	Re 5 30 000/-

Anandragar, Cross Road Satellite, Ahmedabad City, Ahmedabad, Shahpur Ward No. 2, District:

3. Mrs. Vidya Kalpesh Hasmukhbhai Chauhan R/O B-21, Vishal Tower,

Anandnagar, Cross Road Satellite, Ahmedabad City, Ahmedabad,

Gujarat-380015					
Outstanding Dues for recovery of which property is being sold	Date/Time of On-Site Inspection of Property with Name of Authorized Officer	Last Date for submission of EMD and Request letter of participation, KYC, Documents, Pan Card, Proof of EMD etc.	Date and Time of E-Auction with auto extension of 5 minutes each		
Rs.1,16,52,648.69/- (Rupees One Crore Sixteen Lakhs Fifty Two Thousand Six Hundred and Fourty Eight and Sixty Nine Paisa only) due as on 25.06.2020 along with interest and other charges	On or before 27.09.2023 10.00 AM to 5.00 PM Authorized Officer: Mr. Avadhut Nalge Mob: 9711037326	On or before 28.09.2023 upto 5.00 PM and EMD through RTGS/NEFT	29.09.2023 Time: 10.00 AM to 1.00 PM		

The Intending Purchasers / Bidders are required to deposit EMD amount either through RTGS / NEFT or by way of Demand Draft / Pay order in the Account No.00030310016156, Name of the Beneficiary: "Hero Fincorp Limited", IFSC Code: HDFC0000003 Terms and Conditions of the E-Auction:

E-Auction is being held on "As is where is Basis" & "As is what is Basis" & "whatever there is Basis" & "Without recourse

Basis" and will be conducted "online" The E-Auction will be conducted through M/s E-Procurement Technologies Ltd. (Helpline No(s): 07961200576/544/594/59 6/531/583/569, 6351896643 and E-mail on support@auctiontiger.net/ maulik.shrimali@auctiontiger.net at their web portal https://sarfaesi.auctiontiger.net.

There is no encumbrance on the property which is in the knowledge of Secured Creditors. However, the intending bidders should make their own independent enquires regarding the encumbrances, title of property put on auction and claims/ rights/ dues/ affecting the property, prior to submitting their bids. In this regard, the E-Auction advertisement does not constitute and will not be deemed to constitute ant commitment or any representation of Hero Fincorp Limited.

The Authorized Officer / Secured Creditor shall not be responsible in any way for any third party claims/ rights/ dues. The sale shall be subject to rules/ conditions/ prescribed under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002. The other terms and conditions of the E-Auction are published in the following website: https://sarfaesi.auctiontiger.net.

Date: 09.09.2023 Sd/- Authorized Officer, Place: Ahmedabad



## STATE BANK OF INDIA

Stressed Assets Management Branch: Paramsiddhi Complex, 2nd Floor, Opp. V.S. Hospital, Ellisbridge, Ahmedabad - 380006, Phone: 079-26580794, Fax: 079-26581137, E-mail: sbi.04199@sbi.co.in, Authorised Officer's Name: Shri. Kamal Kumar Garg, (M): 9799053400

SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTY Appendix - IV-A (See Proviso to Rule 8 (6)) E-AUCTION SALE NOTICE FOR SALE OF IMMOVABLE ASSETS UNDER THE SECURITISATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002 READ WITH PROVISO TO RULE 8(6) OF THE SECURITY INTEREST (ENFORCEMENT) RULES, 2002

Notice is hereby given to the public in general and in particular to the Borrower(s), Director (s) and Guarantor(s) that the below described immovable assets charged/mortgaged to the Secured Creditor, the Physical possession of which has been taken by the Authorised officer of State Bank of India, the Secured Creditor, will be sold on "As is Where is", As is What is", "Whatever there is" and "Without Recourse" basis on 25.09.2023 for recovery of Rs. 3,08,35,196.57/- (Rupees Three Crores Eight Lakhs Thirty Five Thousands One Hundred Ninety Six Rupees Fifty Seven Paisa only) as on 17.11.2022 and interest, expenses & costs thereon and thereafter, asked to pay vide demand Notice dated 18.11.2022 (The said notice was un served, bank therefore published demand notice on 20.12.2022 in Financial Express (English + Gujarati) All Gujarat Combo) less : Recoveries thereafter if any due to the secured creditor from M/s. Margo Ply & Boards Pvt. Ltd (Borrower) and Directors / Guarantors / Mortgagors : (1). Shri Sandeepkumar Puranchand Gupta, (2). Shri Ajay Puranchand Gupta and (3). Smt. Kritika Sandeep Gupta.


The Bidders should get themselves registered on https://www.mstcecommerece.com/auctionhome/ibapi/index.jsp by providing requisite KYC documents and registration fee as per the practice followed by M/s. MSTC Ltd well before the auction date.

### Date & Time of Public E-auction 25.09.2023 from 11:00 AM to 01:00 PM with unlimited extension of 10 minutes each. Reserve Price (Rs.) **Bid Increase** Date & Time of Property ID No. & EMD (Rs.) Amount (Rs.) 16.09.2023 SBIN200006194214 Rs. 3,20,00,000/-Rs. Time:

Residential Open Plot: All that piece and parcel of Non Agricultural land of immovable Property being Residential Plot bearing Block No. 182 of Mouje - Bopal, Plot No. F-01-34, Sector F-01, in Sterling City within Sterling Co. Operative Housing Society Limited, Near Shiv Ashish School, Mouje - Bopal, Taluka - Daskroi, Ahmedabad, Ahmedabad, 380058, (Urban), Admeasuring Total Area: 486.62 Sq. Mtrs In the name of Shri Sandeep Puranchand Gupta and Shri Ajay Puranchand Gupta. (Physical Possession) (Located at Sterling City, Bopal, Ahmedabad and very near to

(Scan here for Direct Link

to E-auction website)



3:00 PM

to 04.00 PM

10,000/-

Property Location: 2FR9+CC5 Ahmedabad, Gujarat or scan here Encumbrances: The intending bidders should make their own independent inquiries regarding the encumbrances, title of property/ies put on auction and claims/ rights/ dues/ affecting the property, prior to submitting their bid. The e-Auction advertisement does not constitute and will not be deemed to constitute any commitment or any representation of the bank.

Rs. 32,00,000/-

/GST/Other taxes to be borne by purchaser over and above bid amount. For detailed terms and conditions of the sale, please refer to the link provided in State Bank of India the Secured Creditor Website: www.sbi.co.in, https://bank.sbi, https://sbi.co.in/web/sbi-in-the-news/auction-notices/sarfaesi-andothers and https://www.mstcecommerce.com/auctionhome/ibapi/index.jsp, https://ibapi.in, or contact to Kamal Kumar Garg AGM&CLO Mob. No. 9799053400 & S Naresh Babu Manager & CO Mob. No. 9440780127 or scan

The property is being sold with all the existing and future encumbrances whether known or unknown to the bank. The

Authorised Officer/ Secured Creditor shall not be responsible in any way for any third-party claims/ rights/ dues. TDS

This Notice should also be considered as 15 days notice to the Borrowers / Guarantors / Mortgagors under Rule 8(6) of the security interest (Enforcement) Rule.2002

Date: 08.09.2023 Place : Ahmedabad

Date: 09/09/2023

Date: 09/09/2023

S P Ring Road and Ambli-Bopal Road)

Authorized Officer, State Bank of India



## DEBTS RECOVERY TRIBUNAL-I

Ministry of Finance, Department of Financial Service, Government of India 2nd Floor, Bhikhubhai Chambers, Nr. Kochrab Ashram, Ellisbridge, Paldi, Ahmedabad-380 006

FORM NO.22 (Earlier 62) [Regulation 37 (1) DRT Regulations, 2015] [See Rule 52 (1) of the Second Schedule to the Income-tax Act, 1961] E- AUCTION/SALE NOTICE THROUGH REGD.AD/DASTI/AFFIXATION/BEAT OF DRUM PROCLAMATION OF SALE UNDER RULES 38, 52(2) OF SECOND SCHEDULE TO THE INCOME TAX ACT. 1961 READ WITH THE RECOVERY OF DEBTS DUE TO BANK AND FINANCIAL INSTITUTIONS ACT, 1993 R.C. No.45/2017 O.A. No. 505/2016

Certificate Holder:- Union Bank of India, Polytechnic, Ahmedabad

Certificate Debtors :- Mr. Tarkeshwar Ramkedar Bhagat

CD No.1. Mr. Tarkeshwar Ramkedar Bhagat

Incremental

Amount

Rs.50,000/-

**Hero Fincorp Limited** 

Residing at: A/7, Shri Ram Nagar, Narol Court, Narol, Ahmedabad-382405 Also at: Duplex No. 6, Laxminagar Duplex, Behind Narol Court, Narol, Ahmedabad

The under mentioned property will be sold by Public E-auction sale on 20th day of October, 2023 for recovery of sum of Rs. 18,24,809.73 (Rupees: Eighteen lacs twenty four thousand eight hundred nine and paisa seventy three only plus interest and cost payable as per Recovery Certificate issued by Hon'ble Presiding Officer, DRT-I (less amount already recovered, if any), from Mr. Tarkeshwar Ramkedar Bhagat.

DESCRIPTION OF PROPERTY

No. of lots	Description of the Property to be sold with the names of the co-owners where the property belongs to defaulter and any other person as co-owners	Reserve Price below which the property will not be sold	EMD 10% of Reserve price or Rounded off
1	2	7	8
Lot No.		Reserve Price (in ₹)	10% EMD (in ₹)
1	All that piece and parcel of Immovable property being Unit. No. 6 bearing land plot area admeasuring 39.60 sq. mtrs. i.e. 47.35 sq. yards together with construction on ground floor admeasuring 27.60 sq. mtrs. and on 1st floor admeasuring 27.60 sq. mtrs. total construction admeasuring 55.20 sq. mtrs. in scheme known as "Laxminagar" of Revenue Survey No. 153, Hissa No., 2, TPS No. 60 (Narol South-II) F. P. No. 70 of mouje Narol Taluka-City, Registration District and Sub District Ahmedabad-5 (Narol).	(1) 399 88 200 PARTON	1,50,000/-

- Revenue assessed upon the property or any part thereof Not known
- 4. Details of any other encumbrance to which property is liable Not known 5. Valuation also state Valuation given, if any, by the Certificate Debtor - No
- 6. Claims, if any, which have been put forward to the property, and any other known particulars bearing on its nature and value - Not known
- Auction/bidding shall only be through online electronic mode through the e-auction website i.e https://www.drt.auctiontiger.net
- The intending bidders should register the participation with the service provider-well in advance and get user ID and password for participating in E-auction. It can be procured only when the requisite earnest money is deposited in

EMD shall be deposited by through RTGS/NEFT latest by 18.10.2023 as per details as under:

Bank Name and Address	Union Bank of India, Shop No. 2, Shivalik-10, Ambawadi-Nehrunagar Road, Ahmedabad-3800015
Account Name	Union Bank of India
Account No.	393301980050000
IFSC Code No.	UBIN0539333
Branch Address	Vastrapur Branch

EMD deposited thereafter shall not be considered for participation in the e-auction

 In addition to above, the copy of PAN Card, Address Proof and Identity Proof, E-mail ID, Mobile Number, in case of the company, copy of board resolution passed by the Board of Directors of the company or any other document confirming representation/attorney of the company and the Receipt/Counter File of such deposit should reach to the said service provider through e- auction website by uploading softcopies on or before 18.10.2023. It is also held that earnest money of unsuccessful bidders shall be returned back in the respective accounts such bidders through the same mode of

Prospective bidder may avail online training from service provider:

E-procurement Technologies Ltd. (Auction Tiger)
B-704, Wall Street-II, Opp. Orient Club, Near Gujarat College, Ellisbridge, Ahmedabad-380006, Gujarat (India).
Mr. Ram Sharma,
Contact No. 079-68136880/68136837 +91 9265562821 / 18, 9978591888
ramprasad@auctiontiger.net & support@auctiontiger.net
Mr. Bhupehdra Dhaka, Mob. +91-8989579178 E-mail Id: ubin0539333@unionbankofinida.bank Mrs. Priyanka Pachauri Mob. +91-8850216867 E-mail Id: cridroahmedabad@unionbankofinida.bank

- Prospective bidders are advised to visit website https://www.drt.auctiontiger.net for detailed terms & conditions and procedure of sale before submitting their bids.
- The property shall not be sold below the reserve price.
- The property shall be sold in 01 lot, with Reserve Price as mentioned above lot. The bidder shall improve offer in multiples of Rs. 10,000/- during entire auction period.
- The property shall be sold "AS IS WHERE BASIS" and shall be subject to other terms and conditions as published on the official website of the e-auction agency.
- The highest bidder shall have to deposit 25% of his final bid amount after adjustment of EMD already paid by immediate next bank working day by 4:00 P.M. through RTGS/NEFT in the account as mentioned above.
- The successful bidder/auction purchaser shall deposit the balance 75% of sale consideration amount on or before 15th day from the date of sale of the property. If the 15th day is Sunday or other Holiday, then on immediate first bank working day through RTGS/NEFT in the account as mentioned above. In addition to the above, the purchaser shall also deposit poundage fee @1% on total sale consideration money (plus ₹ 10) through DD in favour of The Registrar, DRT-I, Ahmedabad. The DD prepared towards poundage's fees shall be submitted directly with the office of Recovery Officer, DRT-I. Ahmedabad.
- In case of default of payment within the prescribed period, the deposit, after deduction the expenses of the sale, may, if the undersigned thinks fit, be forfeited to the Government Account and the defaulting purchaser shall forfeit all claims to the property or the amount deposited. The property shall be resold forthwith, after the issue of fresh proclamation of sale. Further the purchaser shall also be liable to make good of any shortfall or difference between his final bid amount and the price for which it is subsequently sold.
- Schedule of auction is as under:-

Date and Time of Inspection	10.10.2023	Between 2.00 PM to 4.00 PM	
Date of uploading proof of EMD/documents	18.10.2023	Up to 04.00 pm	
Date and Time of E-Auction	20.10.2023	Between 12.00 Noon to 1.00 pm (with auto extension clause of 5 minutes, provided sale shall be completed by 3.00 pm)	

The Recovery Officer has the absolute right to accept or reject any bid or bids or to postpone or cancel the e-auction without assigning any reasons.

Issued under my hand and seal of this Tribunal on this 28th Day of August, 2023.

Recovery Officer-II, DRT-I, Ahmedabad

Bandhan Bank Limited

Bandhan Bank Limited

Ahmedabad



### NARMADA AGROBASE LIMITED (L15494GJ2013PLC073468)

Regd office: 613/P-1, IJ Pura (Jethaji) Dhanpura Road, Tal. Jotana, Mahesana Gujarat 384421 India

**Email:** infonarmadaagrobase@gmail.com • website: www.narmadaagrobase.com NOTICE OF THE 11<sup>™</sup> ANNUAL GENERAL MEETING TO BE HELD THROUGH VIDEO CONFERENCING ("VC") OR OTHER AUDIO-VISUAL MEANS ("OAVM")

Notice is hereby given that the 11<sup>th</sup> Annual General Meeting of NARMADA **AGROBASE LIMITED** will be held on Saturday 30<sup>th</sup> September, 2023 at 11.30 A.M. IST through video conferencing ("VC")/other Audio-Visual Means ("OAVM") Facility to transact the Ordinary Business, as set out in the Notice of the 11th AGM, in compliance with the applicable provisions of the Companies Act. 2013 and Rules framed thereunder and SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 read with General Circular No. 20/2020 dated May 5, 2020 and subsequent Circulars issued from time to time and General Circular No 10/2022 dated December 28, 2022 read with relevant circulars issued by the Securities and Exchange Board of India (SEBI), from time to time (hereinafter collectively referred to as "Circulars)", has allowed the Companies to conduct the AGM through Video Conferencing (VC) or Other Audio Visual Means (OAVM) during the calendar year 2023. In Compliance with the provisions of the Companies Act, 2013 ("Act"), SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI Listing Regulations") and MCA Circulars, the 11<sup>th</sup> AGM of the Company is being held through VC/ OAVM.

compliance with the aforesaid MCA Circulars and SEBI Circular, Notice of the AGM along with the Annual Report 2022-23 is being sent only through electronic mode to those Members whose email addresses are registered with the Company / Depositories. Members who requires physical copy of the Annual-Report, may request for the same. Members may note that the Notice and Annual Report 2022-23 will also be available on the Company's website www.narmadaagrobae.com, websites of the Stock Exchanges i.e BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com respectively and on the website of National Securities Depository Limited (NSDL) at www.evoting.nsdl.com. The Procedure / Instruction for e-voting and joining AGM are provided in the notice of the AGM.

The remote e-voting period commences on Wednesday, September 27, 2023 (9.00 A.M. IST) and ends on Friday, September 29, 2023 (5.00 P.M. IST). During this period, Members of the Company, holding shares either in physical form or in dematerialized form, as on the cut-off date of Friday, September 22, 2023, may cast their votes electronically. Members attending the AGM through VC/ OAVM, who have not cast their votes by remote e-voting shall be able to exercise their vote through e-voting during the AGM. The Members of the Company holding shares on the "cut-off date" of September 22, 2023 are entitled to vote on the resolutions proposed. The Members of the Company holding shares on the "cut-off date" of September 22, 2023 are entitled to vote on the resolutions proposed. Members wishing to claim dividends that remain unclaimed are requested to correspond with the RTA mentioned above or the Company Secretary of the Company or at cs@narmadaagrobase.com.

Members are requested to notify immediately any change of their address and bank particulars and updating their emails and mobile nos to Depository Participants and in case their shares are held in dematerialised form, and to the Company if shares are held in physical form without any delay to receive the notice of AGM or the login credentials for the E-voting by email.

In case of any members have any queries or issues regarding remote e-voting may refer the Frequently Asked Questions ("FAQs") and e-voting manual available at https://www.evoting.nsdl.com under help section or write an email to evoting@nsdl.co.in or call at toll free no 1800-222-990 or contact the Company Secretary of the company at cs@narmadaagrobase.com

> By order of the Board For, Narmada Agrobase Limited Sd/-

Date: 08<sup>th</sup> September, 2023 Place: Ahmedabad

Nidhi Jain **Company Secretary** 

Bandhan Regional Office: Netaji Marg, Nr. Mithakhali Six Roads, Ellisbridge, Ahmedabad-6. Phone: +91-79-26421671-7 Ellisbridge, Ahmedabad-6. Phone: +91-79-26421671-75

# SYMBOLIC POSSESSION NOTICE

NOTICE is hereby given under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002, the Authorized Officer issued demand notice to the borrower(s) on the date mentioned against the account stated hereinafter calling upon them to repay the amount within 60 days from the date of receipt of said notice. The borrower(s) having failed to repay the amount, notice is hereby given to the public in general and in particular the borrower(s) that the undersigned has taken the symbolic possession of the property described herein below under Section 13(4) of the said Act read with Rule 8 of the said Rules on the date mentioned against the account. The borrower(s) in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealing with the property will be subject to the charge of the Bank for the amounts, interest, costs and charges thereon. The borrowers'/mortgagors' attention is invited to the provisions of sub-section (8) of Section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Name of borrower(s), Loan Account No.	Description of the property mortgaged (Secured Asset)	Date of Demand Notice	Date of Symbolic Possession Notice	O/s Amount as on date of Demand Notice
Mr. Dhaneshgiri Vasudevgiri Gosai Mr. Vasudevgiri Baldevgiri Goswami 20001060003749	All that piece and parcel of the immovable property admeasuring about 45 sq.mtrs, situated at Survey No. TPS 22, Final Plot No. 298, Block No.1 as plan A, House No.205, 2nd Floor, AMC LIG 4 Aavas Yojna, Nr. Swagat Bunglows, Nr. Matrushri Party Plot, Chandkheda(A), Ahmedabad, Gujarat-382424 and bounded by: North: Margin, East: Aavas No.206, West: Aavas No.204, South: Aavas No.202	12.06.2023	05.09.2023	Rs.7,00,084.19
Place: Ahmedabad		30	3. 10	Authorised Officer




Bandhan Regional Office: Netaji Marg, Nr. Mithakhali Six Roads, Ellisbridge, Ahmedabad-6. Phone: +91-79-26421671-Ellisbridge, Ahmedabad-6. Phone: +91-79-26421671-75

# PHYSICAL POSSESSION NOTICE

NOTICE is hereby given under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in the exercise of powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002, the Authorized Officer issued demand notice to the borrower(s) on the date mentioned against the account stated hereinafter calling upon them to repay the amount within 60 days from the date of receipt of said notice. The borrower(s), having failed to repay the amount notice is hereby given to the public in general and particular to the borrower(s) that the undersigned has taken physical possession of the property described herein below in exercise of the powers conferred on him under section 13(4) of the said Act read with Rule 8 of the said Rules on the date mentioned against the loan account. The borrower(s) in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealing with the property will be subject to the charge of the Bank for the amounts, interest, costs and charges thereon. The borrowers'/mortgagors' attention is invited to the provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available to redeem the secured asset.

Description of the property mortgaged (Secured Asset)	Date of Demand Notice	Possession Notice	Outstanding Amt. as on Date of Demand Notice
All that piece and parcel of the immovable property admeasuring about 1260 sq. ft. situated at Survey No. 481/6, FP 37, TP No. 1, Plot/House No. 18, Ganesh Park 2; B/h IOC Colony, Nr. Surva Govind Society, Viramgam, Ahmedabad, Gujarat – 382150 and bounded by: North: Plot No. 17, South: Plot No. 19, East: Plot No. 31, West: Society Road	18.03.2020	03.09.2023	Rs.13,02,752.11 as on 18.03.2020 Rs. 20,25,852.33 as on 03.09.2023
	All that piece and parcel of the immovable property admeasuring about 1260 sq. ft. situated at Survey No. 481/6, FP 37, TP No. 1, Plot/House No. 18, Ganesh Park 2; B/h IOC Colony, Nr. Surva Govind Society, Viramgam, Ahmedabad, Gujarat – 382150 and bounded by:	All that piece and parcel of the immovable property admeasuring about 1260 sq. ft. situated at Survey No. 481/6, FP 37, TP No. 1, Plot/House No. 18, Ganesh Park 2; B/h IOC Colony, Nr. Surya Govind Society, Viramgam, Ahmedabad, Gujarat – 382150 and bounded by:	All that piece and parcel of the immovable property admeasuring about 1260 sq. ft. situated at Survey No. 481/6, FP 37, TP No. 1, Plot/House No. 18, Ganesh Park 2; B/h IOC Colony, Nr. Surya Govind Society, Viramgam, Ahmedabad, Gujarat – 382150 and bounded by:



CIN: L17290GJ2005PLC046345 Registered Add: 10 Mill Officers Colony, Behind Old Rbi, Ashram Road Ahmedabad Gj 380009

Notice is hereby given that the 13<sup>th</sup> Annual General Meeting (13<sup>th</sup> AGM) of the Members of **Riddh**Corporate Services Limited will be held on Thursday, 28<sup>th</sup> September, 2023 at 11:00 a.m. to ransact the business, as set out in the Notice of the 13<sup>th</sup> AGM. The Company has sent the Annua

transact the business, as set out in the Notice of the 13" AGM. The Company has sent the Annual Report along with Notice convening AGM on Wednesday, 6" September, 2023, through electronic mode to all the Members whose e-mail IDs are registered with the Company's Registrar & Share Transfer Agent, M/S. PURVA SHAREGISTRY (INDIA) PVT. LTD/Depository Participant(s) in accordance with the Circular issued by the Ministry of Corporate Affairs dated 5" May, 2020 and 13" April, 2020 and the Securities and Exchange Board of India circular dated 12" May, 2020. The Annual Report along with the Notice convening the AGM is also available on the website of the Company at www.riddhicorporate.co.in, BSE Limited at www.bseindia.com and on the website of Central Depository Services (India) Limited (CDSL) at www.evoltinglindia.com.

Notice is also hereby given that pursuant to the provisions of section 91 of the Companies Ac

2013, the Register of Members and Share Transfer Books of the Company will remain closed from Friday 22<sup>rd</sup> September, 2023 to Thursday 28<sup>rh</sup> September, 2023 (both the days inclusive) for the ourpose of 13<sup>rh</sup> AGM of the Company.

Pursuant to the provisions of Section 108 of the Act and Rule 20 of the Companies (Managemen

Pursuant to the povisions or Section 108 of the Act and Rule 20 of the Companies (wanagement and Administration) Rules, 2014 as amended and Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, members are provided with the facility to cast their vote electronically through e-voting services provided by the CDSL on all resolutions as set forth in the 13th AGM Notice. The voting rights of the members shall be in proportion to the equity shares held by them in the paid-up equity share capital of the Company as on Thursday, September, 21, 2023 (cut-off date).

The remote e-voting period commences on Monday, 25° September, 2023 at 9.00 a.m. and will end on Wednesday, 27° September, 2023 at 5.00 p.m. During this period, the Members may cast their vote electronically. The remote e-voting module shall be disabled by CDSL thereafter. Those Members, who shall be present in the AGM and had not cast their votes on the Resolutions through

emote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote throug

Frount gysternounty ter-Adw.

The manner of remote e-voting and voting at the AGM by members holding shares lematerialized mode, physical mode and for members who have not registered their emaders is provided in the Notice of the AGM.

Any person, who acquires shares of the Company and becomes a Member of the Company after the Notice has been sent electronically by the Company and holds shares as on the cut-off date; may obtain the login ID and password by sending a request to helpdesk evoting@cdslindia.com. However, if he/she is already registered with CDSL for remote e-voting, then he/she can use his/her existing User ID and password for casting the votes.

Members whose email addresses are already registered with the Company/Depositories, may follow the instructions for e-voting during the AGM as provided in the Notice of the AGM. Members

whose email addresses are not registered with the Company/Depository may follow the below process for registering or updating their email addresses.

Members holding shares in electronic/ Demat form, please update your email address with your

Phone : 079-26580767, Email : investor@rcspl.net Web : www.riddhicorp NOTICE OF THE 13<sup>™</sup> ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE AND REMOTE E-VOTING INFORMATION

NARMADA AGROBASE LIMITED
(L15494GJ2013PLC073468) Regd office: 613/P-1, IJ Pura (Jethaji) Dhanpura Road, Tal. Jotana, Mahesana Gujarat 384421 India Email: infonarmadaagrobase@gmail.com • website: www.narmadaagrobase.com NOTICE OF THE 11™ ANNUAL GENERAL MEETING TO BE HELD THROUGH VIDEO CONFERENCING ("VC") OR OTHER AUDIO-VISUAL MEANS ("OAVM")

Notice is hereby given that the 11<sup>th</sup> Annual General Meeting of **NARMADA AGROBASE LIMITED** will be held on Saturday 30<sup>th</sup> September, 2023 at 11.30 A.M.
IST through video conferencing ("VC")/other Audio-Visual Means ("OAVM") Facility to transact the Ordinary Business, as set out in the Notice of the 11<sup>th</sup> AGM, in compliance with the applicable provisions of the Companies Act, 2013 and Rules framed thereunder and SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 read with General Circular No. 20/2020 dated May 5, 2020 and subsequent Circulars issued from time to time and General Circular No 10/2022 dated December 28, 2022 read with relevant circulars issued by the Securities and Exchange Board of India (SEBI), from time to time (hereinafter collectively referred to as "Circulars)", has allowed the Companies to conduct the AGM through Video Conferencing (VC) or Other Audio Visual Means (OAVM) during the calendar year 2023. In Compliance with the provisions of the Companies Act, 2013 ("Act"), SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI Listing Regulations") and MCA Circulars, the 11th AGM of the Company is being held through VC/ OAVM.

In compliance with the aforesaid MCA Circulars and SEBI Circular, Notice of the AGM along with the Annual Report 2022-23 is being sent only through electronic mode to those Members whose email addresses are registered with the Company Depositories. Members who requires physical copy of the Annual-Report, may request for the same. Members may note that the Notice and Annual Report 2022-23 will also be available on the Company's website **www.narmadaagrobae.com**, websites of the Stock Exchanges i.e BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com respectively and on the website of National Securities Depository Limited (NSDL) at www.evoting.nsdl.com. The Procedure / Instruction for e-voting and joining AGM are provided in the notice of the AGM.

The remote e-voting period commences on Wednesday, September 27, 2023 (9.00 A.M. IST) and ends on Friday, September 29, 2023 (5.00 P.M. IST). During this period, Members of the Company, holding shares either in physical form or in dematerialized form, as on the cut-off date of Friday, September 22, 2023, may cast their votes electronically. Members attending the AGM through VC/ OAVM, who have not cast their votes by remote e-voting shall be able to exercise their vote through e-voting during the AGM. The Members of the Company holding shares on the "cut-off date" of September 22, 2023 are entitled to vote on the resolutions proposed. The Members of the Company holding shares on the "cut-off date" of September 22, 2023 are entitled to vote on the resolutions proposed. Members wishing to claim dividends that remain unclaimed are requested to correspond with the RTA mentioned above or the Company Secretary of the Company or at cs@narmadaagrobase.com.

Members are requested to notify immediately any change of their address and bank particulars and updating their emails and mobile nos to Depository Participants and in case their shares are held in dematerialised form, and to the Company if shares are held in physical form without any delay to receive the notice of AGM or the login credentials for the E-voting by email.

In case of any members have any queries or issues regarding remote e-voting may refer the Frequently Asked Questions ("FAQs") and e-voting manual available at https://www.evoting.nsdl.com under help section or write an email to evoting@nsdl.co.in or call at toll free no 1800-222-990 or contact the Company Secretary of the company at cs@narmadaagrobase.com

> By order of the Board For, Narmada Agrobase Limited Sd/-

Date: 08th September, 2023 Place: Ahmedahad

Company Secretary

પૂજાવેસ્ટ્રર્ન મેટાલિક્સ લિમિટેડ

सीनः L२७३२०GJ२०१۶PLC०६४३१४ રજુ. ઓફિસ: પ્લોટ નં. ૧, ફેઝ ૨, જુઆઇડીસી, ડારેડ, જામનગર, ગુજરાત-૩૬૧૦૦૪, (ભારત) દેલ. નં.: ૨૮૮-૨૭૩૦૦૮૮, વેબસાઇટ: www.poojametal.com ઇમેઇલ: poojametals@gmail.com

કંપનીની 7મી વાર્ષિક સામાન્ય સભા અને ઈ-વોર્ટિંગની સૂચના

આથી સુચના આપવામાં આવે છે કે કોર્પોરેટ બાબતોના મંત્રાલય (MCA) અને પરિપત્ર SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4 દ્વારા જારી કરાયેલ 28 ડિસેમ્બર, 2022ના સામાન્ય પરિપત્ર નં. 10/2022ના અનુસંધાનમાં તારીખ 5 જાન્યુઆરી, 2023 ના રોજ સેબી દ્વારા જારી કરવામાં આવે છે (ત્યારબાદ સામૂહિક રીતે "ધ પરિપંત્ર" તરીકે ઓળખવામાં આવે છે), કંપનીઓને સામાન્ય સ્થળે સભ્યોની ભૌતિક હાજરી વિના, વીસી દ્વારા એજીએમ યોજવાની મંજૂરી આપવામાં આવે છે. આથી, પરિપત્રોના પાલનમાં, કંપનીની એજીએમ શનિવાર, 30 સપ્ટેમ્બર, 2023 ના રોજ બપોરે 12:00 વાગ્યે વીસી દ્વારા યોજવામાં આવી છે. (IST). 7મી એજીએમની કાર્યવાહીનું સ્થળ કંપનીની નોંધાયેલ ઓફિસ એટલે કે પ્લોટ નં. 1, ફેઝ II, જીઆઈડીસી, દરેડ જામનગર-361004, ગુજરાતની નોટિસમાં દર્શાવ્યા મુજબ સામાન્ય વ્યવસાયો અને વિશેષ વ્યવસાયોના વ્યવહાર માટે રહેશે. 7મી એજીએમ. કોર્પોરેટ બાબતોના મંત્રાલય (MCA) દ્વારા જારી કરાયેલ 28 ડિસેમ્બર, 2022ના સામાન્ય

પરિપત્ર નં. 10/2022 અને તારીખ 5 જાન્યુઆરીના SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4ના પરિપત્ર અનુસાર, SEBI દ્વારા જારી કરાયેલ 2023 (ત્યારબાદ સામૂહિક રીતે "પરિપત્રો" તરીકે ઓળખવામાં આવે છે) વાર્ષિક અહેવાલ 2022-23 સાથે AGM ની સૂચના ફક્ત તે સભ્યોને જ ઇલેક્ટ્રોનિક મોડ દ્વારા મોકલવામાં આવી છે જેમના ઇમેઇલ સરનામાં કંપની/ડિપોઝિટરીઝમાં નોંધાયેલા છે. સભ્ય નોંધ લે કે નોટિસ અને વાર્ષિક અહેવાલ 2022-23 કંપનીની વેબસાઇટ www.poojametals.com પર, BSE લિમિટેડની વેબસાઇટ www.bseindia.com પર અને નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) એટલે કે www.evoting.nsdl.com વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે.

એમસીએના પરિપત્રોના પ્રકાશમાં, શેરધારકો ડીમેટ સ્વરૂપે અથવા ભૌતિક સ્વરૂપમાં ઇક્વિટી શેર ધરાવે છે અને જેમણે તેમના ઇમેઇલ સરનામાં સબમિટ કર્યા નથી અને પરિજ્ઞામે જેમને 7મી એજીએમ અને વાર્ષિક અહેવાલ 2022-23ની નોટિસ આપી શકાઈ નથી, નીચે આપેલ પ્રક્રિયાને અનુસરીને તેઓ અસ્થાયી રૂપે સેવા આપી શકે છે. તેમના ઈ-મેલ સરનામાં રજીસ્ટર કરાવોઃ

- 1. જો શેર ભૌતિક સ્થિતિમાં રાખવામાં આવ્યા હોય, તો કૃપા કરીને ફોલિયો નંબર, શેરધારકનું નામ, શેર પ્રમાણપત્રની સ્કેન કરેલી નકલ (આગળ અને પાછળ), PAN (પાન કાર્ડની સ્વ-પ્રમાશિત સ્કેન કરેલી નકલ), આધાર (આધાર કાર્ડની સ્વ-પ્રમાશિત સ્ક્રેન કરેલી નકલ) info@poojametal.com પર ઇમેઇલ દ્વારા પ્રદાન કરો.
- 2. જો શેર ડીમેટ મોડમાં રાખવામાં આવ્યા હોય, તો કૃપા કરીને DPID-CLID (16 અંકનો DPID + CLID અથવા 16 અંકનો લાભાર્થી ID), નામ, ક્લાયન્ટ માસ્ટર અથવા કોન્સોલિડેટેડ એકાઉન્ટ સ્ટેટમેન્ટની કોપિ, PAN (PAN કાર્ડની સ્વ-પ્રમાશિત સ્કેન કરેલી નકલ) આધાર (આધાર કાર્ડની સ્વ-પ્રમાશિત સ્ક્રેન કરેલી નકલ) info@poojametal.com પર પ્રદાન કરો.
- વપરાશકર્તા ID અને પાસવર્ડ મેળવવા માટે વૈકલ્પિક રીતે સભ્ય ઇ-મેઇલ પર evoting@nsdl.co.in પર કેસ તરીકે પોઇન્ટ (1) અથવા (2) માં ઉલ્લેખિત વિગતોને સાબિત કરીને વિનંતી મોકલી શકે છે .

ઈ-મેલ એડ્રેસની સફળ નોંધણી પછી, શેરધારકને 7મી એજીએમ અને વાર્ષિક રિપોર્ટ 2022-23ની નોટિસની સોક્ટ કોપી અને 7મી માટે ઈ-વોટિંગ સક્ષમ કરવા માટે યુઝર-આઈડી અને પાસવર્ડ સાથે ઈ-વોટિંગ માટેની પ્રક્રિયા મળશે. એજીએમ. કોઈપણ પ્રશ્નોના કિસ્સામાં, શેરધારક કંપનીને info@poojametal.com પર પત્ર લખી શકે છે. શેરધારકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમના ડિપોઝિટરી સહભાગીઓ (ઓ) સાથે તેમના ઈમેલ આઈડીની નોંધશ્રી/અપડેટ કરે કે જેમની સાથે તેઓ તેમના ડીમેટ એકાઉન્ટ્સ જાળવી રાખે છે, જો જરૂરી દસ્તાવેજો સબમિટ કરીને શેર ડીમટીરિયલાઈઝ્ડ મોડમાં રાખવામાં આવ્યા હોય.

શનિવાર, સપ્ટેમ્બર 23, 2023 ("કટ-ઓફ તારીખ") ના રોજ જે સભ્યોના નામ સભ્યોના રજિસ્ટરમાં અથવા ડિપોઝિટરીઝ દ્વારા જાળવવામાં આવેલા લાભદાયી માલિકોના રજિસ્ટરમાં નોંધાયેલા છે, તેઓ ફક્ત દૂરસ્થ ઇ-ની સુવિધા મેળવવા માટે હકદાર હશે. વાર્ષિક સામાન્ય સભામાં મતદાન તેમજ ઈ-વોટિંગ.

કંપની અધિનિયમ, 2013 ની કલમ 108 ની જોગવાઈઓને અનુસરીને તે હેઠળ બનાવેલા નિયમો (સુધાર્યા પ્રમાજે) અને સેબી (LODR) રેગ્યુલેશન્સ, 2015 (સુધારેલા મુજબ) ના નિયમન 44 અને ઉપરોક્ત એમસીએ પરિપત્રો સાથે વાંચવામાં આવે છે. કંપની રિમોટની સુવિધા પૂરી પાડે છે. ઇ-વોટિંગ અને એજીએમની તારીખે ઇ-વોટિંગ તેના સભ્યોને એજીએમમાં વ્યવહાર કરવાના વ્યવસાયના સંદર્ભમાં. આ હેતુ માટે, કંપનીએ ઈલેક્ટ્રોનિક માધ્યમથી મતદાનની સુવિધા માટે NSDL સાથે કરાર કર્યો છે.

રિમોટ ઈ-વોટિંગ બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023 ના રોજ સવારે 9:00 વાગ્યે શરૂ થશે. અને શુક્રવાર, સપ્ટેમ્બર 29, 2023 ના રોજ સાંજે 5:00 વાગ્યે સમાપ્ત થશે. આ સમયગાળા દરમિયાન, કટ-ઓફ તારીખે શેર ધરાવનાર કંપનીના સભ્યો ઈલેક્ટ્રોનિક રીતે તેમનો મત આપી શકે છે (રિમોટ ઈ-વોટિંગ). સભ્યો નોંધ લે કે a) NSDL દ્વારા મતદાન માટેની ઉપરોક્ત તારીખ અને સમય પછી રિમોટ ઈ-વોટિંગ મો.શુલને અક્ષમ કરવામાં આવશે અને એક વખત સભ્ય દ્વારા ઠરાવ પર મત આપવામાં આવે, પછી સભ્યને તેને બદલવાની મંજૂરી આપવામાં આવશે નહીં; b) ઈ-વોટિંગની સુવિધા 7મી એજીએમમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે; અને c) જે સભ્યોએ 7મી એજીએમ પહેલાં રિમોટ ઈ-વોટિંગ દ્વારા તેમનો મત આપ્યો છે તેઓ પણ 7મી એજીએમમાં હાજરી આપી શકે છે પરંતુ તેઓ ફરીથી તેમનો મત આપવા માટે હકદાર રહેશે નહીં. 7મી વાર્ષિક સામાન્ય સભાની સૂચનામાં રિમોટ ઈ-વોટિંગ/ ઈ-વોટિંગ માટેની

કોઈપણ વ્યક્તિ, જે કંપનીના શેર મેળવે છે અને એજીએમની નોટિસ મોકલ્યા પછી અને કટ-એફ તારીખ એટલે કે 23 સપ્ટેમ્બર, 2023ના રોજ શનિવારના રોજ શેર રાખ્યા પછી કંપનીના સભ્ય બને છે, તેમને એજીએમની નોટિસનો સંદર્ભ લેવા વિનંતી કરવામાં આવે છે. મત આપવા માટે USER ID અને પાસવર્ડ મેળવવા માટેની પ્રક્રિયા અપનાવવામાં આવશે. ઈ-વોટિંગ માટે કોઈપજ્ઞ પ્રશ્નોના કિસ્સામાં, તમે શેરધારકો માટે વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs) અને www.evoting.nsdl.com ના ડાઉનલોડ વિભાગ પર ઉપલબ્ધ શેરધારકો

વિગતવાર પ્રક્રિયા પૂરી પાડવામાં આવી છે.

સ્થળઃ જામનગર

તારીખઃ ૦૮ સપ્ટેમ્બર, ૨૦૨૩

માટે ઈ-વોટિંગ વપરાશકર્તા માર્ગદર્શિકાનો સંદર્ભ લઈ શકો છો અથવા ટોલ ફ્રી નંબર : 1800-222-990 પર કોલ કરી શકો છો. અથવા evoting@nsdl.co.in પર વિનંતી મોકલો. સભ્યો કંપનીની નોંધાયેલ ઓફિસમાં કંપનીના કંપની સેક્રેટરી શ્રી તેજુસ રમેશચંદ્ર પીઠાડિયાનો પણ સંપર્ક કરી શકે છે અથવા કોઈપણ વધુ સ્પષ્ટતા માટે www.poojametals.com પર ઈ-મેલ લખી શકે છે.

સભ્યો VC/OAVM સુવિધા દ્વારા વાર્ષિક સામાન્ય સભામાં હાજરી આપી શકે છે અને તેમાં ભાગ લઈ શકે છે. VC/OAVM દ્વારા વાર્ષિક સામાન્ય સભામાં જોડાવા માટેની સૂચનાઓ વાર્ષિક સામાન્ય સભાની સૂચનામાં આપવામાં આવી છે. જો શેરધારકો/સભ્યોને એજીએમમાં ભાગ લેવા અંગે કોઈ પ્રશ્નો અથવા સમસ્યાઓ હોય, તો તમે evoting@nsdl.co.in પર ઈમેલ લખી શકો છો અથવા અમને કોલ કરોઃ ટેલિફોનઃ 1800-222-990. કંપની અધિનિયમ, 2013 ની ક્લમ 103 હેઠળ કોરમની ગણતરીના હેતુઓ માટે VC/OAVM દ્વારા મીટિંગમાં હાજર રહેલા સભ્યોની ગણતરી કરવામાં આવશે.

પૂજાવેસ્ટર્ન મેટાલિક લિમિટેડ વતી. એસડી/-સુનીલ દેવરામ પંચમતીયા ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર

ડીનઃ 02080742

**PALM JEWELS LIMITED** 

CIN:L36910GJ2005PLC046809
gistered Add: C/205, D/205, 2<sup>™</sup> Floor, Super Mall Besides Lal Bungalow, C.G. Road, Ahmedabad-380009, Gujarat, India
Phone: +91 8460449722 Email:compiliance.pjl@gmail.com Web: www.palmjewelsltd.com

NOTICE OF 18<sup>™</sup> ANNUAL GENERAL MEETING

Notice is hereby given that the 18<sup>th</sup> Annual General Meeting (AGM) of the Members of **Palm Jewel Limited** is scheduled to be held on **Saturday**, 30<sup>th</sup> **September**, **2023 at 11:00 AM** at the registere office of the Company at C/205, D/205, 02<sup>th</sup> Floor, Super Mall Besides Lal Bungalow, C.G. Road Office of the Coffinging at C/205, DIZVO, CZ Floor, Super Main Desides Lat Bungalow, C.G. Road, Ahmedabad - 380009, Gujarat, India to transact the business as set out in the Notice of the 18th AGM, which is being circulated for convening the AGM. The Company has already dispatched the Annual Report for the Financial Year 2022-23 along with the Notice convening 18th AGM through electronic mode to the Shareholders whose email address are registered with the Company and / or Depositories in accordance with the Circulars issued by the Ministry of Corporate Affairs and Securities and Exchange Board of India. The Annual Report along with the Notice of 18th AGM also available on the website of the company at www.palmjewelsltd.comand on the website of National Securities Depository Limited (NSCI). I at www.wextign.gad(c...) he website of National Securities Depository Limited (NSDL) at www.evoting.nsdl.com.

the website of National Securities Depository Limited (NSDL) at www.evoting.nsdi.com.

As Per Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Managemen and Administration) Rules, 2014, Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and the Secretarial Standards on General Meeting ("SS-2" issued by the Institute of Company Secretary of India, the Company is providing facility to all its Members to cast their vote on all resolutions to be set forth in the Notice of the AGM by electronic means (e-voting) by using electronic voting system provided by the NSDL. The voting rights of the members shall be in the proportion to the equity share held by them in the paid up equity share to the Company as on Friday, September 22, 2023 (the "cut-off date"). The details are required resolution to the proportion of the Companies and voting the Secretarian Resolutions. ursuant to the provision of the Companies Act, 2013 and rules made thereunder are given below The Book closure period shall commence on 24th September, 2023 and ends on 30th September

- 2023 (both days inclusive); . The remote e-voting period will commence at 09:00 a.m. on Wednesday, September 27, 2023 and will end at 05:00 p.m. on Friday, September 29, 2023.
- Cut-off date for determining rights of entitlement of e-voting is Friday, September 22, 2023;. The members will not be allowed to vote through remote e-voting beyond the period as specific above;
- . Shareholder acquiring the share of the company and becomes the members of the compar after sending of the Notice and holding Shares as of the cut-off date may follow steps mention the Notice of AGM to exercise their voting rights;
- . The Members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend participate in the AGM but shall not be entitled to cast their vote again.
- The Board has appointed M/s. Neelam Somani & Associates, Practising Company Secretary to act as the Scrutinizer to scrutinize the e-voting procedure, who shall submit the results of voting to the Chairman.
- In case of any queries/grievances pertaining to remote e-voting you may refer to the Frequent! Asked Questions ('FAQs') for Shareholders and e-voting user manual for Shareholders available at www.evoting.nsdl.com.under.help.section.or.contact.at 022-23058542/43.

FOR, PALM JEWELS LIMITED Place : Ahmedabad Managing Director (DIN: 00543440) Date: 07/09/2023

SHISH INDUSTRIES LTD

શીશ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ

**રજીસ્ટર્ડ ઓફિસ** : ટીપી નંબર ૪, આરએસ નં. ૧૧ પૈકી, ૧૨–૧૩ બી પૈકી, પ્લોટ સી,

પહેલો માળ, ૧૧, ૧૨ સૂર્યપુર મિલ કમ્પાઉન્ડ, વરાછા રોડ, સુરત-૩૯૫ ૦૦૬. ગુજરાત, ભારત

કંપનીની સામાન્ય મીટિંગની સૂચના,

બુક બંધ, નક્કી કરેલી તારીખ અને ઇ-મતદાનની સૂચના આથી સૂચના આપવામાં આવે છે કે કોઈ એક સ્થળે સભ્યોની શારીરિક હાજરી વિના વિડિયો

સુંગઠન (VC) અથવા અન્ય ઓડિયો વિડિયો માધ્યમ (OAVM) દ્વારા સામાન્ય સભા યોજુવા માટે કોર્પોરેટ બાબતોનું મંત્રાલય દ્વારા તારીખ ૮ મી એપ્રિલ ૨૦૨૦ ના રોજ જારી કરાયેલા સામાન્ય પરિપત્ર નં. ૧૪/૨૦૨૦, તારીખ ૧૩ મી એપ્રિલ ૨૦૨૦ ના રોજ જારી

કરાયેલા સામાન્ય પરિપત્ર નં. ૧૭/૨૦૨૦ અને તારીખ ૨૮ મી ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજ

જારી કરાયેલા સામાન્ય પરિપત્ર નં. ૧૧/૨૦૨૨ પ્રમાણે શીશ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (કંપની) ના સભ્યોની સામાન્ય સભા (ઈજીએમ) શનિવારે તારીખ ૩0 મી સપ્ટેમ્બર, ૨0૨૩ એ સવારનાં

૧૧:૦૦ વાગ્યે ઈજીએમની સૂચનામાં જજ્ઞાવ્યા મુજબનાં ખાસ અને સામાન્ય વ્યવસાયો નો

ઉપર્ જજ્ઞાવેલા કોર્પોરેટ બાબતોનું મુંત્રાલય નાં પરિપત્રો પ્રમાણે અને સેબી દ્વારા તારીખ ૧૩ મી મે, ૨૦૨૨ ના રોજ જારી કરાયેલ પરિપત્ર નં. સેબી/એચએ/સીએફડી/સીએમડીર/

સીઆઈઆર/પી/ ૨૦૨૨/૬૨, ઈજીએમની સચના ફક્ત તે જ સભ્યોને ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા મોકલવામાં આવી રહી છે, જેમના ઇમેઇલ સરનામાંઓ કંપની / ડિપોઝિટરીઝમાં

શુક્રવાર તારીખ ૧ સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ નોંધાયેલા છે. સભ્યોને નોંધ લેવા વિનંતિ છે કે

ઈંજીએમની સૂચના કંપનીની વેબસાઇટ www.shishindustries.com પર, બીએસઈ

લિમિટેડની વેબસાઇટ www.bseindia.com પર અને નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી

ક્ષિમિટેડ (એનએસડીએલ) ની વેબસાઇટ www.evoting.nsdl.com પર પણ મુકવામાં

ઉપર જજ્ઞાવેલા કોર્પોરેટ બાબતોનું મંત્રાલય નાં પરિપત્રો પ્રમાણે એ બધા સભ્યો કે જે ડીમેટ સ્વરૂપમાં અથવા ભૌતિક સ્વરૂપમાં કંપનીના ઇક્વિટી શેર ધરાવે છે અને પોતાનાં ઇ-મેઇલ

સરનામાં નૃથી નોંધાવ્યા જેના લીધે ઈજીએમની સૂચના નથી મોકલી શકાઇ એ સભ્યો

બસ્થાયીરૂપે તેમના ઇ-મેઇલ સરનામા કંપની સાથે આ પ્રમાણે નોંધાવી શકે છે, (એ) જો

મૌતિક સ્વરૂપમાં શેર ધરાવો છો તો શેરધારકનું નામ, શેર પ્રમાણપત્રની સ્ક્રેન કરેલી નક્લ

(આગળ અને પાછળ), પાન (પાનકાર્ડની સ્વૅ-પ્રમાશ્ચિત સ્ક્રેન કરેલી નકલ), આધાર

(આધારકાર્ડની સ્વ-પ્રમાશિત સ્ક્રેન કરેલી નકલ) compliance@shishindustries.com પર ઇ-મેઇલ કરી ને, (બી) જો ડીમેટ સ્વરૂપમાં ધરાવો છો તો નામ, DPID-CLID (16

અંકનો DPID + CLID અથવા 16 અંકોના લાભાર્થી ID), ક્લાયંટ માસ્ટર અથવા

કન્સોલિડેટેડ એકાઉન્ટ સ્ટેટમેન્ટની નકલ, પાન (પાનકાર્ડની સ્વ-પ્રમાશિત સ્ક્રેન કરેલી નકલ),

આધાર (આધારકાર્ડની સ્વ-પ્રમાશિત સ્કેન કરેલી નકલ) compliance@shishindustries.com પર ઇમેઇલ કરી ને, ૩) અથવા તો સભ્યો (આધારકાર્ડની સ્વ-પ્રમાશિત સ્ક્રેન કરેલી

પોઈન્ટ (એ) અથવા (બી) માં જણાવેલ વિગતો ઇ-મેઇલ દ્વારા evoting@nsdl.co.in પર

ઇ-મેઇલ સરનામાંની સફળ નોંધશી પછી, સભ્ય ને ઈજીએમ સંદર્ભે ઈજીએમની સૂચના ની

ઇલેક્ટ્રોનિક નકલો, યુઝર આઇડી અને પાસવર્ડ અને ઇલેક્ટ્રોનિક મતદાન માટેનો પ્રક્રિયા

મને ઇલેક્ટ્રોનિક મતદાન માટે સક્ષમ બનાવવા માટે મોકલવામાં આવશે. કોઈપણ પ્રશ્નો

કિસ્સામાં, સભ્યો compliance@shishindustries.com પર કંપનીને વિનંતી કરી શકે છે.

શેરધારકોને વિનંતી છે કે તેઓ તેમની સંપૂર્ણ બેંક વિગતો અને ઇમેઇલ આઈડી નોંધણી /

અપડેટ કરવા માટે તેમના ડિપોઝિટરી સહભાગીઓ, જેમની સાથે તેઓ ડિમટીરીયલાઇઝ્ડ

સ્વરૂપમાં હિસ્સો ધરાવે છે, તેને જરૂરી દસ્તાવેજો આપી ને તેમના ડિમેટ ખાતાની જાળવણી

કંપનીમાં કોઈપણ શેરહોલ્ડરો ભૌતિક સ્વરૂપમાં ઇક્વિટી શેર ન ધરાવતાં હોવાને કારણે,

કંપનીના સભ્યોના રજિસ્ટર અને શેર ટ્રાન્સફર પુસ્તકો બંધ રહેશે નહીં. એ બધા સભ્યો

જેમના નામ ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૩ (નક્કી કરેલી તારીખ) ના રોજ કંપનીના રજિસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ દ્વારા જાળવવામાં આવેલા સભ્યોના રજિસ્ટરમાં અને ડિપોઝિટરીઓ

પાસેથી પ્રાપ્ત થયેલા લાભદાયી માલિકો દેખાય છે ફક્ત એ જ સભ્યો દૂરસ્થ ઇલેક્ટ્રોનિક

મતદાન અને સામાન્ય સભા નાં દિવસે ઇલેક્ટ્રોનિક મતદાન ની સુવિધાનો લાભ મેળવવાના

કંપનીઓનો ધારો, ૨૦૧૩ ("ધારો") ની કલમો ૧૦૮ ની જોગવાઈઓ અને અન્ય લાગુ જોગવાઈઓને અનુસરીને અને કંપનીઓ (સંચાલન અને વહીવટ) નિયમો, ૨૦૧૪ (સમય-

સમય પર સુધારેલા મુજબ) ("નિયમો) ના નિયમો ૨૦ ને સાથે વાંચીને અને સેબી (સ્થિબદ્ધ

જવાબદારી અને જાહેરાત આવશ્યકતાઓ) નિયમનો, ૨૦૧૫ (સેબી સૂચિઓ નિયમો) ના

નિયમન ૪૪ અને અન્ય લાગુ કાયદા અને નિયમો ધ્યાનમાં રાખીને, કંપની તેના સભ્યોને

ઇજીએમમાં વ્યવસાયોને વ્યવહાર કરવા માટે દૂરસ્થ ઇલેક્ટ્રોનિક મતદાન અને સામાન્ય સભા

નાં દિવસે ઇલેક્ટ્રોનિક મતદાન ની સુવિધા પ્રદાન કરી રહી છે. કંપનીએ તમામ સભ્યોને

ઇલેક્ટ્રોનિક મતદાન ની સુવિધા આપેવા માટે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ

. સભ્યો નોંધી શકે છે કે દરસ્થ ઇલેક્ટોનિક મતદાન બધવાર, ૨૭ સપ્ટેમ્બર, ૨0૨૩. નાં રોજ

સવારનાં ૦૯:૦૦ વાગ્યો થી શરૂ થશે અને શનિવાર, ૨૯ સપ્ટેમ્બર, ૨0૨૩ નાં રોજ સાંજનાં

૦૫:૦૦ વાગતાં (બંને દિવસો સંહિત) પુર્જા થશે. આ સમયગાળા દરમિયાન, એ બધા સભ્યો

કે જેમના નામ નક્કી કરેલી તારીખ ના રોજ કંપનીના રજિસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ દ્વારા

જાળવવામાં આવેલા સભ્યોના રજિસ્ટરમાં અને ડિપોઝિટરીઓ પાસેથી પ્રાપ્ત થયેલા

મોકલીને યુઝર આઈડી અને પાસવર્ડ મેળવવા માટે વિનંતી કરી શકે છે.

યવહાર મંજૂર કરવા માટે VC / OAVM દ્વારા યોજવામાં આવશે.

આવ્યા છે.

હકદાર રહેશે.

"એનએસડીએલ") સાથે કરાર કર્યો છે.

ટેલિફોન : +૯૧ ૨૯૧ રેપપ ૦૫૭૯, વેબસાઇટ: www.shishindustries.com;

ย-มิย์ตะ compliance@shishindustries.com

### **GAUTAM GEMS LIMITED**

CIN: L36911GJ2014PLC078802

Registered Add: 3<sup>soc</sup> Floor, Office-301, Sumukh Super CompOund, Vasta Devadi Road, Surat- 395004, Gujarat.

Phone: 912612538046 Email: complianceggl@gmail.com Web: www.gautamgems.com NOTICE OF 10<sup>™</sup> ANNUAL GENERAL MEETING

Notice is hereby given that the 10<sup>th</sup> Annual General Meeting (AGM) of the Members of **Gautan Gems Limited** is scheduled to be held on **Saturday, 30<sup>th</sup> September, 2023 at 12:00 PM** througl /ideo Conference ("VC") / Other Audio Visual Means ("OAVM) to transact the business as set out the Notice of the 10" AGM, which is being circulated for convening the AGM. The Company har already dispatched the Annual Report for the Financial Year 2022-23 along with the Notice convening 10" AGM through electronic mode to the Shareholders whose email address are registered with the Company and / or Depositories in accordance with the Circulars issued by the Ministry of Corporate Affairs and Securities and Exchange Board of India. The Annual Report along with the Notice of 10° AGM also available on the website of the company at www.gautamgems.com and on the website of National Securities Depository Limited (NSDL) at www.evoting.nsdl.com.

As Per Section 108 of the CompaniesAct, 2013 read with Rule20 of the Companies (Manageme and Administration) Rules, 2014, Regulation 44 of SEBI (Listing Obligations and Disclosur Requirements) Regulations, 2015 and the Secretarial Standards on General Meeting ("SS-2" issued by the Institute of Company Secretary of India, the Company is providing facility to all its Members to cast their vote on all resolutions to be set forth in the Notice of the AGM by electronic means (e-voting) by using electronic voting system provided by the NSDL. The voting rights of the members shall be in the proportion to the equity share held by them in the paid up equity share o the Company as on Friday, September 22, 2023 (the "cut-off date"), The details are required ursuant to the provision of the Companies Act, 2013 and rules made thereunder are given below: The Book closure period shall commence on 24th September, 2023 and end on 30th September

- 2023 (both days inclusive); The remote e-voting period will commence at 09:00 a.m. on Wednesday, September 27, 2023
- and will end at 05:00 p.m. on Friday, September 29, 2023. Cut-off date for determining rights of entitlement of e-voting is Friday, September 22, 2023;
- The members will not be allowed to vote through remote e-voting beyond the period as specifie
- Shareholder acquiring the share of the company and becomes the members of the company after sending of the Notice and holding Shares as of the cut-off date may follow steps mention
- the Notice of AGM to exercise their voting rights; The Members who have cast their vote by remote e-voting prior to the AGM may also
- attend/narticipate in the AGM but shall not be entitled to cast their vote again. The Board has appointed M/s. Neelam Somani & Associates, Practising Company Secretary to
- act as the Scrutinizer to scrutinize the e-voting procedure, who shall submit the results of votin
- In case of any queries/grievances pertaining to remote e-voting you may refer to the Frequently Asked Questions (FAQs') for Shareholders and e-voting user manual for Shareholders available at www.evoting.nsdl.com under help section or contact at 022-23058542/43.

  FOR, GAUTAM GEMS LIMITED

sd/- GAUTAM P SHETH Place : Surat Managing Director (DIN: 06748854) Date: 07/09/2023

Depository Participants. However, Members may temporarily register the same with the Company's Registrar & Share Transfer Agent i.e. M/S PURVA SHAREGISTRY (INDIA) PVT. LTD at https://www.purvashare.com/email-and-phone-updation/on their website www.purvashare.com/ in the Register your Email id tab by providing details such as Name, DPID, Client ID, PAN, mobile number and e-mail address. In case of any queries pertaining to e-voting members may refer to the Frequently Asked Questions ("FAQs") and the e-voting manual available at www.evotingindia.com, under help section or write an email to helpdesk.evoting@cdslindia.com

Place : Ahmedabad Date: 6th September, 2023

यूनियन बैंक 🕠 Union Bank

भिલકत नं. ४

તારીખ : ૦૯.૦૯.૨૦૨૩

સ્થળ : આણંદ

રીજનલ ઓક્સિ - આણંદ. દુકાન નં. ૨૨૨-૨૨७, બીજો માળ, . મારૂતિ સોલારીસ, મધુબન રીસોર્ટ પાસે, આણંદ - સોજીત્રા રોડ, આણંદ - ૩૮૮૦૦૧.

વેચાણ નોટીસ સ્થાવર મિલકતો માટે વેચાણ

e-voting system during the AGM.

Registration of e-mail addresses:

६ - हराळिची मोडीस : બપોરે ૧૨.૦૦ થી સાંજે ૫.૦૦ કલા

FOR, RIDDHI CORPORATE SERVIES LIMITED sd/- MUSTAFA MUFADDALBHAI SIBATRA

Compliance Officer & Company Secretary

સિક્યોરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ - ૨૦૦૨ નો નિયમ ૮(૬) ના પ્રોવિઝોની સાથે સિક્યુરીટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શીયલ એસેટ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી **ઇન્ટરેસ્ટ એક્ટ-૨૦૦૨ અન્વચે સ્થાવર મિલકતોનું ઇ - હરાજી વેચાણ માટે વેચાણ નોટીસ**. આથી જાહેર જનતાને તથા ઉધારકર્તાઓ અને જામીનદારોને વિશેષ રૂપથી નોટીસ આપવામાં આવે છે કે સિક્યોર્ડ ક્રેડીટરને ગીરો મુકેલ નીચે દર્શાવેલ સ્થાવર મિલકર્તોનો **ચુનિચન બેંક ઓફ ઇન્ડિચા** ના અધિકૃત અધિકારી દ્રારા કબજો લેવાયેલ છે, નીચે દર્શાવેલ ઉધારકર્તાઓ અને જામીનદારો પાસેથી નીચે દર્શાવેલ બાકી લેશાંના વસુલાત હેતુ આવી મિલકતોનું **"જ્યાં છે, જેમ છે અને જે કંઇ પણ છે**" ના ધોરણે નીચે દર્શાવેલ તારીખે વેચાણ કરવામાં આવશે. અનામત કિંમત સાથે ઈએમડી ની રકમ પણ નીચે જણાવેલ છે.

શાખાનું નામ અને સરનામું	આણંદ શાખા : કાશી ધામ, મહર્ષિ દયાનંદ માર્ગ, આણંદ, જીલ્લો - ૩૮૮૦૦૧, શાખા મેનેજર : શ્રી પ્રમોદકુમાર ચાદવ (મો) : ૯૦૭૫૪૪૯૧૭૬	
ઉદ્યારકર્તા/જામીનદારોનું નામ	શ્રી ઇરેનિયસ પોલ પો (ઉધારકર્તા) અને શ્રીમતી પો કલ્પના ઇરેનિયસ (સહ-ઉધારકર્તા)	
બાકી લ્હેણી રકમ	રૂા. ७,०७,०७२.५२, તા. ૩૧.૦૩.૨૦૨૧ + ચડત વ્યાજ, કોસ્ટ અને અન્ય ખર્ચાઓ (ત્યાર પછી આવેલ વસુલાતને આદિાન)	
ਮਿલકત નં. ૧	તમામ ભાગ અને હિસ્સા સાથે દુકાન નં.૨૧૬, ક્રિષ્ના કોમ્પલેક્ષ, બેઝમેન્ટ માળ, આર.એસ.નં.૧૩૨૭/એ પૈકી સીટીએસ નં. ૨૧૯૨/બી/૧, મ્યુનીસીપલ નં.૧૨/૨/૧૩૭/૭, બોરસદ ચોકી, આણંદ, તાલુકો અને જીલ્લો આણંદ. ક્ષેત્રફળ : ૧૪.૮૬ સ્કે.મીટર. ચતુઃસીમા :- ઉત્તરે : દુકાન નં.૨૧૫, દક્ષિણે : દુકાન નં.૨૧૭, પૂર્વે : આણંદ-બોરસદ રોડ પછી માર્જીનની જગ્યા, પશ્ચિમે : દુકાન. (સાંકેતિક કબજો)	
હરાજીની તારીખ અને સમય ઃ ૨૬.૦૯.૨૦૨૩ ના રોજ બપોરે ૧૨.૦૦ થી સાંજે ૫.૦૦ કલાકે ● અનામત કિંમત ઃ રૂા. ૫,૮૦,૦૦૦/- ● અર્નેસ્ટ મની ડીપોઝીટ ઃ રૂા. ૫૮,૦૦૦/-		
ઉદ્યારકર્તા/જામીનદારોનું નામ	શ્રી કાનન વેઇંગ સિસ્ટમ્સ, પ્રો.શ્રી ભરતભાઇ જશભાઇ પટેલ (ઉદારકર્તા) અને શ્રી કમલેશભાઇ મોતીભાઇ પારેખ (સહ-બંધનકર્તા / જામીનદાર) અને શ્રીમતી રેખાબેન ભરતભાઇ પટેલ (સહ-બંધનકર્તા/જામીનદાર)	
બાકી લ્હેણી રકમ	રૂા. ૨૮,૬૬,૬૦૫.૨૦, તા. ૩૧.૦૩.૨૦૨૧ + ચડત વ્યાજ, કોસ્ટ અને અન્ય ખર્ચાઓ (ત્યાર પછી આવેલ વસુલાતને આધિન)	

Galescii/ Meloicieigi oliei	જામીનદાર) અને શ્રીમતી રેખાબેન ભરતભાઈ પટેલ (સહ-બંધનકર્તા/જામીનદાર)
બાકી લ્હેણી રકમ રૂંગ. ૨૮,૬૬,૬૦૫.૨૦, તા. ૩૧.૦૩.૨૦૨૧ + ચડત વ્યાજ, કોસ્ટ અને અન્ય ખર્ચાઓ (ત્યાર પછી આવેલ વસુલાતને આધિ	
મિલકત નં. ૨	તમામ ભાગ અને હિસ્સા સાથેનો સબ પ્લોટ નં.૭, સૂર્યાદિપ ટેનામેન્ટ, આર.એસ. નં. પ૩૯/૧, + ૪, એફપી નં.૨૧, ટીપીએસ ૭ સતાવીસ ગામ સ્કુલ પાસે, ૮૦ ફીટ રોડ, આણંદ -૩૮૮૦૦૧, ક્ષેત્રફળઃ ૧૨૨.૫૦ સ્કે.મીટર, <b>ચતુઃસીમા ઃ- ઉત્તરે</b> : રોડ, <b>દક્ષિણે</b> ઃ ટીપીએસ નં.૭ નો પ્લોટ નં. ૨૪,૨૫,૨૬, <b>પૂર્વે</b> ઃ સૂર્યાદીપન નો એસ. પ્લોટ નં.૬, <b>પશ્ચિમે</b> : સૂર્યાદીપન નો એસ. પ્લોટ નં.૮. (સાંકેતિક કબજો)
હરાજીની તારીખ અને સમય : ૨૬.૦૯.૨૦૨૩ ના રોજ બપોરે ૧૨.૦૦ થી સાંજે ૫.૦૦ કલાકે ● અનામત કિંમત : રૂા. ૩૦,૮૫,૫૦૦/- ● અર્નેસ્ટ મની ડીપોઝીટ : રૂા. ૩,૦૮,૫૫૦/-	
શાખાનું નામ અને સરનામું નડીયાદ શાખા : કર્મવીર ટાવર, કપડવંજ રોડ, નડીયાદ, ગુજરાત, શાખા મેનેજર : શ્રી સતેન્દ્ર આર્ચ (મે) : ૮૩૪૮૮७७७०૪ ઉદ્યારકર્તા/જામીનદારોનું નામ શ્રી વિનુભાઇ નાગજીભાઇ ભરવાડ અને શ્રી બાલાભાઇ નાગજીભાઇ ભરવાડ	

બાકી લ્હણી રકમ	રૂા. ૧૫,૯૪,૯૪૩.૮૬, તા.૩૦.૦૯.૨૦૧७ + ચક્ત વ્યાજ, કાસ્ટ અને અન્ય ખચાઆ (ત્યાર પછા આવલ વસુલાતને આદિન)	
મિલક્ત નં. ૩ મિલક્ત નં. ૩ એરીયા - ૬૦૬ સ્કે.કીટ ચતુઃસીમાઃ - ઉત્તરેઃ પ્લોટ નં. એક/૧૧૨, દક્ષિણેઃ પ્લોટ નં. એક/૧૧૦, પૂર્વેઃ પ્લોટ નં. એક/૧૧૦, પૂર્વેઃ પ્લોટ નં. એક/૧૧૦, પૂર્વેઃ પ્લોટ નં. એક/૧૧૦, પૂર્વેઃ પ્લોટ નં. એક/૧૧૦, પ્રાફ્રામેઃ સોસાયટી રે		
હરાજીની તારીખ અને સમય ઃ ૨૬.૦૯.૨૦૨૩ ના રોજ બપોરે ૧૨.૦૦ થી સાંજે ૫.૦૦ કલાકે ● અનામત કિંમત ઃ રૂા. ૧૧,૫૯,૨૦૦/- ● અનેંસ્ટ મની ડીપોઝીટ ઃ રૂા. ૧,૧૫,૯૨૦		
ઉદ્યારકર્તા/જામીનદારોનું નામ	પ્રાસ્કર્તા/જામીનદારોનું નામ શ્રી ચિરાગ રાધવેન્દ્ર તિવારી અને શ્રી કાર્તિક રાધવેન્દ્ર તિવારી	
બાકી લ્હેણી રકમ રૂા. ૩૦,૦૨,૧૫૮, તા.૩૧.૦૧.૨૦૧૭ + ચડત વ્યાજ, કોસ્ટ અને અન્ય ખર્ચાઓ (ત્યાર પછી આવેલ વસુલાતને આધિન)		
	न्याय त्यांश अने हिस्सा आशेनो हार नं १९२ दर्धतीर संदर्भाश ना निरंगार शब्दान अंटीया ला स्ट्रे भीटर <b>अनःसीमा ः हिन्दे</b> रखेश नं १९१	

ı	હરાજીની તારીખ અને સમય :	૨૬.૦૯.૨૦૨૩ ના રોજ બપોરે ૧૨.૦૦ થી સાંજે ૫.૦૦ કલાકે ● અનામત કિંમત : રૂા. ૧૬,૩૧,૧૫૦/- ● અર્નેસ્ટ મની ડીપોઝીટ : રૂા. ૧,૬૩,૧૧૫/-
1		
ı	ઉદ્યારકર્તા/જામીનદારોનું નામ	કું. વિનીતાબેન જચક્રિષના ગાંધી અને શ્રી આશુતોષ ભાનુપ્રસાદ રાણા
ı	બાકી લ્હેણી રકમ	રૂા. ૨૫,૫૬,७૬૦/-, તા.૩૧.૧૦.૨૦૧७ + ચડત વ્યાજ, કોસ્ટ અને અન્ય ખર્ચાઓ (ત્યાર પછી આવેલ વસુલાતને આદિન)
I		તમામ ભાગ અને હિસ્સા સાથે ઘર નં. બી-૨૧. કર્મવીરસંદરબાગ, રાધાસ્વામી સત્સંગ ભવન પાસે. પીજ રોડ. ગામ: ટંડેલ, નડિયાદ, ગજરાત એરીયા ૮૦૭ સ્કે.કીટ.

દક્ષિણે ઃ સુંદરબાગ કંમ્પાઉન્ડવોલ પછીની બાઉન્ડ્રી, પૂર્વે ઃ એચ.નં.૯૭, પશ્ચિમે ઃ સોસાયટી એપ્રોચ રોડ. (પ્રત્યક્ષ કબજો)

, ,	9
બાકી લ્હેણી રકમ	રૂા. ૨૫,૫૬,७૬૦/-, તા.૩૧.૧૦.૨૦૧७ + ચડત વ્યાજ, કોસ્ટ અને અન્ય ખર્ચાઓ (ત્યાર પછી આવેલ વસુલાતને આદિન)
G	તમામ ભાગ અને હિસ્સા સાથે ઘર નં. બી-૨૧, કર્મવીરસુંદરબાગ, રાધાસ્વામી સત્સંગ ભવન પાસે, પીજ રોડ, ગામઃ ટંડેલ, નડિયાદ, ગુજરાત એરીયા ૮૦૭ સ્કે.ફીટ. <b>ચતુઃસીમા :- ઉત્તરે</b> : સોસાયટી એપ્રોચ રોડ, <b>દક્ષિણે</b> : ઘર નં, બી-૨૦, <b>પૂર્વે</b> : જમીનનો એસ.નં.૧૩૬/૨, <b>પશ્ચિમે</b> : ઘર નં, બી-૨૨. (પ્રત્યક્ષ કબજો)
હરાજીની તારીખ અને સમય ઃ ૨૬.૦૯.૨૦૨૩ ના રોજ બપોરે ૧૨.૦૦ થી સાંજે ૫.૦૦ કલાકે ● અનામત કિંમત ઃ રૂા. ૧૬,૫૧,૫૫૦/- ● અર્નેસ્ટ મની ડીપોઝીટ ઃ રૂા. ૧,૬૫,૧૫૫/-	

બાકી લ્હેશી સ્કમ રૂ. ૨૬,૯૨,૯૨૫/-, તા.૨७.૦૨.૨૦૧७ + ચડત વ્યાજ, કોસ્ટ અને અન્ય ખર્ચાઓ (ત્યાર પછી આવેલ વસુલાતને આદિન) તમામ ભાગ અને હિસ્સા સાથે ઘર નં. ૮૨, કર્મવીરસુંદરબાગ, પીજ રોડ, ગામઃ ટંડેલ, નડિયાદ, ગુજરાત એરીયા ૭૫.૦૦ સ્કે.મી. <b>ચતુઃસીમા</b> ઃ- ઉત્ત	ઉદ્યારકર્તા/જામીનદારોનું નામ	શ્રી પ્રતિકકુમાર રાજેન્દ્રકુમાર પટેલ અને ધારાબેન પ્રતિકકુમાર પટેલ
તમામ ભાગ અને હિસ્સા સાથે ઘર નં. ૮૨, કર્મવીરસુંદરબાગ, પીજ રોડ, ગામઃ ટડેલ, નડિયાદ, ગુજરાત એરીયા ૭૫.૦૦ સ્કે.મી. <b>ચતુઃસીમા</b> ઃ- ઉત્ત	બાકી લ્હેણી રકમ	રૂા. ૨૬,૯૨,૯૨૫/-, તા.૨७.૦૨.૨૦૧७ + ચડત વ્યાજ, કોસ્ટ અને અન્ય ખર્ચાઓ (ત્યાર પછી આવેલ વસુલાતને આધિન)
મિલકત નં. ક ઘર નં. ૮૩, દક્ષિણો ઃ ઘર નં, ૮૧, પૂર્વે ઃ સોસાયટી એપ્રોચ રોડ, પશ્ચિમે ઃ ઘર નં, ૯૫. (પ્રત્યક્ષ કબજો)		તમામ ભાગ અને હિસ્સા સાથે ઘર નં. ૮૨, કર્મવીરસુંદરબાગ, પીજ રોડ, ગામઃ ટંડેલ, નડિયાદ, ગુજરાત એરીયા ૭૫.૦૦ સ્કે.મી. <b>ચતુઃસીમા ઃ- ઉત્તરે</b> ઃ ઘર નં. ૮૩ <b>, દક્ષિણે</b> ઃ ઘર નં, ૮૧, <b>પૂર્વે</b> ઃ સોસાયટી એપ્રોચ રોડ, <b>પશ્ચિમે</b> ઃ ઘર નં, ૯૫. (પ્રત્યક્ષ કબજો)

erigon circion oldi tidia .	co. eccess on the data acres at the grown state of the co. ecc.
ઉદ્યારકર્તા/જામીનદારોનું નામ	શ્રી વિપુલ બાલકિષ્ના ભરૂ અને શ્રીમતી જાગૃતિ વિપુલ ભરૂ
બાકી લ્હેણી રકમ	રૂા. ૨૫,૯૯,૨૩७.૮૦, તા.૩૧.૦७.૨૦૧७ + ચડત વ્યાજ, કોસ્ટ અને અન્ય ખર્ચાઓ (ત્યાર પછી આવેલ વસુલાતને આધિન)
l Green in	તમામ ભાગ અને હિસ્સા સાથે ઘર નં. ૧૭૨, કર્મવીરસુંદરબાગ, પીજ રોડ, ગામઃ ટંડેલ, નડિયાદ, ગુજરાત એરીયા ૮૦૭ સ્કે.ફીટ. <b>ચતુઃસીમા ઃ- ઉત્તરે</b> ઃ ઘર નં. ૧૭૧ <b>દક્ષિણ</b> ે : ઘર નં. ૧૭૩. <b>૫૦ઁ</b> : ઘર નં. ૧૯૫. <b>૫૭મ્મે</b> : સોસાયટી રોડ.(પ્રત્યક્ષ ક્બજો)

ामलङ्गत न. ७	ઘર નં. ૧૭૧ <b>દક્ષિણ</b> ઃ ઘર નં, ૧૭૩, <b>પૂર્વે</b> ઃ ઘર નં, ૧૬૫, પશ્ચિમે ઃ સોસાયટી રોડ.(પ્રત્યક્ષ કબજો)
હરાજીની તારીખ અને સમય :	૨૬.૦૯.૨૦૨૩ ના રોજ બપોરે ૧૨.૦૦ થી સાંજે ૫.૦૦ કલાકે ● અનામત કિંમત : રૂા. ૧૬,૩૧,૧૫૦/- ● અર્નેસ્ટ મની ડીપોઝીટ : રૂા. ૧,૬૩,૧૧૫/-

ઉદ્યારકર્તા/જામીનદારોનું નામ શ્રી યોગેશભાઈ રમેશભાઈ પંડચા અને શ્રીમતી ખુશ્બુ આર. પંડચા રૂા. ૧૬,૦૨,૩૬૫/-, તા.૩૧.૦૯.૨૦૧૯ + ચડત વ્યાજ, કોસ્ટ અને અન્ય ખર્ચાઓ (ત્યાર પછી આવેલ વસુલાતને આધિન) બાકી લ્હેણી રકમ ામામ ભાગ અને હિસ્સા સાથે પ્લોટ નં.એ/૧૬ પર ઘર. કર્મવીરનગર -Ⅷ, નયા-બીલોદરા, ગામ-બીલોદરા, નડિયાદ, ગુજરાત. પ્લોટ એરિયા ૯૨૧ भिલકत नं. ८ સ્કે.ફીટ્સ, **ચતુઃસીમા**ઃ- **ઉત્તરે**ઃ કેનાલ, **દક્ષિણે**ઃ પ્લોટ નં.એ/૧૫, **પૂર્વે**ઃ એપ્રોચ રોડ, પશ્ચિ**મે**ઃ સર્વે નં. ૧૧૧ પૈકી ખેતીલાયક જમીન.(પ્રત્યક્ષ કબજો)

હરાજીની તારીખ અને સમય : ૨૬.૦૯.૨૦૨૩ ના રોજ બપોરે ૧૨.૦૦ થી સાંજે ૫.૦૦ કલાકે ● અનામત કિંમત : રૂા. ૧૦,૫૮,૨૫૦/- ● અર્નેસ્ટ મની ડીપોઝીટ : રૂા. ૧,૦૫,૮૨૫/-

Ľ		
I I—	ઉદ્યારકર્તા/જામીનદારોનું નામ	શ્રી કમલેશભાઈ રમેશભાઈ ચોહાણ અને શ્રીમતી સ્મીતાબેન કમલેશભાઈ ચોહાણ
	બાકી લ્હેણી રકમ	રૂા. ૨૧,૫૨,૫૯૦.૫૨, તા.૩૧.૦૧.૨૦૧७ + ચડત વ્યાજ, કોસ્ટ અને અન્ય ખર્ચાઓ (ત્યાર પછી આવેલ વસુલાતને આદિાન)
	Grand at 1 a	તમામ ભાગ અને હિસ્સા સાથે ઘર નં. ૨૩, કર્મવીરસુંદરબાગ, ટંડેલ, તા. નિડયાદ, ગુજરાત એરીયા ૬૦ સ્કે.મીટર, <b>ચતુઃસીમા ઃ- ઉત્તરે</b> ઃ એચ. નં.૨૨, <b>દક્ષિણે</b> ઃ એચ. નં.૨૪, , <b>પૂર્વે</b> ઃ સોસાયટી એપ્રોચ રોડ, <b>પશ્ચિમે</b> ઃ એચ. નં.૧૮, .(પ્રત્યક્ષ કબજો)
П	हराञ्चनी तारीफ अने समय :	. ૨૬.૦૬.૨૦૨૩ ના રોજ બપોરે ૧૨.૦૦ થી સાંજે ૫.૦૦ કલાકે 🌑 અનામત કિંમત : ૩ા. ૧૮.૨૩.૫૦૦/- 🕲 અર્નેસ્ટ મની ડીપોઝીટ : ૩ા. ૧.૮૨.૩૫૦/-

શાખાનું નામ અને સરનામું	ઉત્તરસંડા શાખા : મધુકુંજ બિલ્ડીંગ, શ્રીજી આઈસ્ક્રીમની પાસે, મેઇન રોડ, તાલુકો - નડીચાદ, ઉત્તરસંડા, જીલ્લો - ખેડા, ગુજરાત - ૩૮७૩७૦, શાખા મેનેજર : શ્રી ઉપેન્દ્રકુમાર, (મો) : ૯७૯૨૦૦૪૦७૪
ઉદ્યારકર્તા/જામીનદારોનું નામ	શ્રી અનિલકુમાર નરોત્તમદાસ ઠક્કર (ઉદ્યારકર્તા), શ્રીમતી ગીતાબેન અનિલકુમાર ઠક્કર (સહ - ઉદ્યારકર્તા),
બાકી લ્હેણી રકમ	રૂા. ૧७,૩૪,૮૩૯.૨७, તા. ૩૧.૦૩.૨૦૨૧ + ચડત વ્યાજ, કોસ્ટ અને અન્ય ખર્ચાઓ (ત્યાર પછી આવેલ વસુલાતને આદિાન)
મિલકત નં. ૧૦	તમામ ભાગ અને હિસ્સા સાથેનો ઘર ઈ-૨૧, કર્મવીર સુંદરવન - III, કર્મવીર વાટીકા -૧ પાસે, મંજીપુરા, તા. નિડયાદ, જીલ્લો - ખેડા. એરીયા ૭૫ સ્કે.મીટર. <b>ચતુઃસીમા :- ઉત્તરે :</b> પ્લોટ નં. ઈ/૨૨, <b>દક્ષિણે :</b> પ્લોટ નં. ઈ/૨૦, <b>પૂર્વે</b> : એપ્રોચ રોડ, પ <b>શ્ચિમે</b> : ઘર નં. ડી/૮૦. (પ્રત્યક્ષ કબજો)
हराळची वारीम अ <b>न्</b> रे अग्रज :	26 06 2022 에 가장 대기를 82 00 위 개야 N 00 ECIL을 및 과제대적 문자적 - 31 86 20 A00년 및 개선구가 개념 단기스템 - 31 8 62 0A0년

ઉદ્યારકર્તા/જામીનદારોનું નામ	શ્રીમતી ભાવનાબેન પ્રદિપકુમાર કેોરાની (ઉદ્યારકતી), શ્રી પ્રદિપકુમાર પીતાંમ્બરદાસ કેોરાની (સહ - ઉદ્યારકર્તા),
બાકી લ્હેણી રકમ	રૂા. ૧૫,૯૫,૬૩૯.૨૨, તા. ૩૧.૦૩.૨૦૨૧ + ચડત વ્યાજ, કોસ્ટ અને અન્ય ખર્ચાઓ (ત્યાર પછી આવેલ વસુલાતને આધિન)
મિલકત નં. ૧૧	તમામ ભાગ અને હિસ્સા સાથેનો ઘર એક-૧૨૧, કર્મવીર સુંદરવન - III, કર્મવીર વાટીકા -૧ પાસે, મંજીપુરા, તા. નિડયાદ, જીલ્લો - ખેડા. એરીયા ૪૪ સ્કે.મીટર. ચતુઃસીમા :- ઉત્તરે : પ્લોટ નં. એક/૧૨૦, દક્ષિષ્ટો : પ્લોટ નં.એક/૧૨૨, પૂર્વે : ૬ મીટર એપ્રોચ રોડ, પશ્ચિમે : પ્લોટ નં.એક/૧૦૮. (પ્રત્યક્ષ કબજો)
હરાજીની તારીખ અને સમય ઃ ૨૬.૦૯.૨૦૨૩ ના રોજ બપોરે ૧૨.૦૦ થી સાંજે ૫.૦૦ કલાકે ● અનામત કિંમત ઃ રૂા.૧૦,૯૬,૫૦૦/- ● અર્નેસ્ટ મની ડીપોઝીટ ઃ રૂા. ૧,૦૯,૬૫૦/-	

હરાજીની તારીખ અને સમય :	૨૬.૦૯.૨૦૨૩ ના રોજ બપોરે ૧૨.૦૦ થી સાંજે ૫.૦૦ કલાકે ● અનામત કિંમત : રૂા.૧૦,૯૬,૫૦૦/- ● અર્નેસ્ટ મની ડીપોઝીટ : રૂા. ૧,૦૯,૬૫૦/-
ઉદ્યારકર્તા/જામીનદારોનું નામ	શ્રીમતી ગાયત્રી હર્ષદકુમાર પંચાલ અને શ્રીમતી પ્રિયંકા હર્ષદકુમાર પંચાલ
બાકી લ્હેણી રકમ	રૂા. ૧૦,૦૩,૫૫૪.૫૫, તા. ૩૧.૦૮.૨૦૧૯ + ચક્ત વ્યાજ, કોસ્ટ અને અન્ય ખર્ચાઓ (ત્યાર પછી આવેલ વસુલાતને આદિાન)
મિલકત નં. ૧૨	તમામ ભાગ અને હિસ્સા સાથેનો ઘર એ/૧૩૬, કર્મવીર સુંદરવન, મંજીપુરા રોડ, નડિયાદ. બિલ્ટઅપ એરીયા ૧૨૪ સ્કે. મીટર. <b>ચતુઃસીમા :- ઉત્તરે</b> : પ્લોટ નં. એ/૧૩૫, <b>દક્ષિણે</b> : પ્લોટ નં.એ/૧૩૭, <b>પૂર્વે</b> : એપ્રોચ રોડ, પ <b>શ્ચિમે</b> : પ્લોટ નં.એ/૧૩૩. (પ્રત્યક્ષ કબજો)
હરાજીની તારીખ અને સમય : ૨૬.૦૯.૨૦૨૩ ના રોજ બપોરે ૧૨.૦૦ થી સાંજે ૫.૦૦ કલાકે ● અનામત કિંમત : રૂા.૨૩,૨૪,७૫૦/- ● અર્નેસ્ટ મની ડીપોઝીટ : રૂા. ૨,૩૨,૪७૫/-	

કરાજી વેચાણના વિગતવાર નિયમો અને શરતો માટે બિકર્સને વેબસાઈટ : https://www.ibapi.in, and www.unionbankofindia.co.in ટેન્ડર પર જવાની સલાહ આપવામાં આવે છે નોંધણી અને લોગીન અને બિડીંગ નિયમો માટે મુલાકાત લો : https://www.mstcecommerce.com/auctionhome/ibapi/index.jsp

(અસલ અંગ્રેજી પરથી અનુવાદ)

અધિકૃત અધિકારી,

યુનિયન બેંક ઓફ ઈન્ડિયા

સતીશકુમાર માણીયા, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર નિયામક ઓળખ નંબર: ૦૨૫૨૯૧૯૧ સ્થળઃ સુરત તારીખઃ ૦૮/૦૯/૨૦૨૩

લાભદાયી માલિકો દેખાય છે ફક્ત એ જ સભ્યો દૂરસ્થ ઇલેક્ટ્રોનિક મતદાનની સુવિધાનો લાભ મેળવવાના હકદાર રહેશે અને આવા સભ્યો ઇલેક્ટ્રોનિક રીતે પોતાનો મત આપી શુકશે. ત્યારબાદ એનએસડીએલ દ્વારા દૂરસ્થ ઇલેક્ટ્રોનિક મતદાન કરવા માટે ઇ-મતદાન મો.ક્યુલ અક્ષમ કરવામાં આવશે. એકવાર સભ્ય દ્વારા ઠરાવ પર મત આપ્યા પછી, તે / તેશ્રીને પછીથી બદલવાની અથવા ફરીથી મત આપવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સામાન્ય સભા નાં દિવસે ઇલેક્ટ્રોનિક મતદાન ની સુવિધા આપવામાં આવશે. જે સભ્યોએ ઇજીએમ પહેલાં દૂરસ્થ ઇલેક્ટ્રોનિક મતદાન દ્વારા પોતાનો મત આપ્યો છે તે પણ ઇજીએમ માં હાજર રહી શકે છે પરંતુ તેઓ ફરીથી મતદાન કરવાનો હકદાર રહેશે નહી. દૂરસ્થ ઇલેક્ટ્રોનિક મતદાન / ઇલેક્ટ્રોનિક મતદાન માટેની વિગતવાર પ્રક્રિયા ઇજીએમ ની સૂર્ચનામાં આપવામાં આવેલી છે. કોઈપણ વ્યક્તિ, જે કંપનીના શેરો ઇજીએમની સૂચના મોકલ્યા પછી મેળવે છે અને નક્કી કરેલી તારીખ પર ધરાવે છે, તે evoting@nsdl.co.in અથવા compliance@shishindustries.com પર વિનંતી મોકલીને યુઝર આઇડી અને પાસવર્ડ અને ઇલેક્ટ્રોનિક મતદાન માટેની પ્રક્રિયા મેળવી શકશે. જો કે, જો તમે દૂરસ્થ ઇલેક્ટ્રોનિક

મતદાન માટે પહેલેથી જ એનએસડીએલ સાથે નોંધાયેલ છે, તો પછી તમે તમારા મત આપવા માટે તમારી હાલની યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરી શકો છો. જો તમે તમારો પાસવર્ડ ભૂલી ગયા છો, તો તમે www.evoting.nsdl.com પર ઉપલબ્ધ "પાસવર્ડ ભૂલી ગયા છો" વિકલ્પનો ઉપયોગ કરીને તમારો પાસવર્ડ ફરીથી સેટ કરી શકો છો.

દુરસ્થ ઇલેક્ટ્રોનિક માધ્યમને લગતાં કોઈપજ્ઞ પ્રશ્નોના કિસ્સામાં, તમે સભ્યો દ્વારા વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs) નો સંદર્ભ લો અને www.evoting.nsdl.com ના ડાઉનલોડ વિભાગ પર ઉપલબ્ધ સભ્યો માટે દૂરસ્થ ઇલેક્ટ્રોનિક મતદાન વપરાશકર્તા માર્ગદર્શિકા અથવા ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૦૨૦ ૯૯૦ અને ૧૮૦૦ ૨૨ ૪૪ ૩૦ પર ફ્રોન કરી શકો છો બથવા evoting@nsdl.co.in પર વિનંતી મોકલી શકો છો. સભ્યો કંપનીની રજિસ્ટર્ડ બોફિસ પર શ્રીમતી વિભા ખંડેલવાલ, કંપની સચિવ અને પાલન અધિકારી, નો સંપર્ક પણ ર્સી શકે છે અથવા compliance@shishindustries.com પર ઇ-મેઇલ લખી શકે છે અથવા વધુ સ્પષ્ટતા માટે +૯૧ ૨૬૧ ૨૫૫ ૦૫૮૭ ફોન કરી શકે છે.

સભ્યો ફક્ત VC / OAVM સવિધા દ્વારા સામાન્ય સભામાં ભાગ લઈ શકે છે. સામાન્ય સભામાં જોડાવા માટેની સૂચના સામાન્ય સભાની સૂચનામાં આપવામાં આવી છે. જો સભ્યો ને ઇજીએમમાં ભાગ ર્લેવા સંબંધિત કોઈ પ્રશ્નો અથવા સમસ્યાઓ છે, તો તમે :voting@nsdl.co.in પર ઇમેઇલ લખી શકો છો અથવા ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૦૨૦ ૯૯૦ અને ૧૮૦૦ ૨૨ ૪૪ ૩૦ પર ફ્ષેન કરી શકો છો. VC / OAVM દ્વારા ઇજીએમમાં ભાગ લેનારા સભ્યોની ગજ્ઞતરી કંપનીઓનો ધારો, ૨૦૧૩ ની ક્લમ ૧૦૩ હેઠળ કોરમની બોર્ડના આદેશ દ્વારા શીશ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ગજ્ઞતરીના હેતુ માટે કરવામાં આવશે.